A
COMPLETE GLOSSARY
OF
Difficult words, phrases and idioms occuring in
THE ROYAL CROWN PRIMER
PART I AND II.

With correct Pronounciations, explanatory Notes
and a translation.

BY

MANILAL DOLATRAM PATEL.
Author of the English Guide, The English Gujarati Dictionary,
The English letter writer, and publisher of the
"Vijay" Magazine &c. &c.

AHMEDABAD.
રાજનગર ટાઇપ ફાઉન્ડરી પ્રીન્ટીંગ પ્રેસમાં જેસંગ મુળજીએ છાપી

ધી રૉયલ ક્રાઉન પ્રાઇમર ભાગ ૧ લા તથા ૨ બીજાનાં
મીનીંગ—(તરજુમા સાથે)

સંવત ૧૯૬૦ (સર્વ હક સ્વાધીન) સને ૧૯૦૪.

Price. 0-6-0

THE ALPHABET.

(ધી ઍલ્ફેબેટ) મૂળાક્ષરો.

અક્ષરમાળા.

છાપેલું વાંચવામાંનાં પહેલા મૂળાક્ષરો.

A	B	C	D	E	F	G	H	I	J
એ	બિ	સિ	ડિ	ઇ	એફ્	જી	એચ્	આઈ	જે

K	L	M	N	O	P	Q	R	S
કે	એલ્	એમ્	એન્	ઓ	પી	ક્યુ	આર	એસ્

T	U	V	W	X	Y	Z.
ટિ	યુ	વિ	ડબલ્યુ	એક્સ્	વાઇ	ઝેડ્.

છાપેલું વાંચવામાંના નાના મુળાક્ષરો.

a	b	c	d	e	f	g	h	i	j	k	l
એ	બિ	સિ	ડિ	ઈ	એફ્	જી	એચ	આઈ	જે	કે	એલ

m	n	o	p	q	r	s	t	u	v
એમ્	એન્	ઓ	પી	ક્યુ	આર	એસ	ટિ	યુ	વિ

w x y z.

ડબ્લ્યુ એકસ્ વાઇ ઝેડ્

લખવાના મોટા મુળાક્ષરો.

A B C D E F G H I J K L M

એ બિ સિ ડિ ઈ એફ્ જી એચ આઇ જે કે એલ એમ

N O P Q R S T U V W X Y Z

એન્ ઓ પિ ક્યુ આર એસ ટિ યુ વિ ડબ્લ્યુએકસવાઇઝેડ

લખવાનાં નાના મુળાક્ષરો.

a b c d e f g h i j k l m n o

એ બિ સિ ડિ ઈ એફ્ જી એચ્ આઇ જે કે એલ્ એમ્ એન્ ઓ

p q r s t u v w x y z

પિ ક્યુ આર એસ્ ટિ યુ વિ ડબ્લ્યુ એકસ્ વાઈ ઝેડ્

Vowels (વાઉએલ્સ) સ્વરાક્ષરો.

A E I O U Y

એ ઇ આઈ ઓ યુ વાઈ

Consonants (કૉન્સોનૅન્ટ્સ) વ્યંજન.

B C D F G H J K L M N

બિ સિ ડિ એફ્ જી એચ જે કે એલ એમ એન

P Q R S T V W X Z

પિ ક્યુ આર એસ ટિ વિ ડબ્લ્યુ એકસ ઝેડ

ઇંગ્રેજી મૂળાક્ષરના દરેક અક્ષરનો નીચે પ્રમાણે ઉચ્ચાર થાય છે.

A.(એ)(અ, એ, આ, ઍ, ઓ, ઑ) ઇંગ્રેજી ઘણી ખરી જાણીતી ભાષાઓની મૂળાક્ષરોમાંનો પહેલો અક્ષર.
વિશેષણ તરીકે વપરાતો શબ્દ, એને ઇંગ્રેજીમાં ઇન્ડેફીનિટ આર્ટિકલ કહે છે. અને એનો અર્થ એક, એકાદ, કંઇક, કોઇએક, એવો થાય છે, અને જ્યારે A "ઉપસર્ગ" તરીકે વપરાયેલો હોય ત્યારે તેનો અર્થ માં, થી, પાસે, ઉપર, વાસ્તે, એવો થાય છે. જેમકે He is asleep (હી ઇઝ એસ્લીપ્) તે (ઉંઘમાં) ઉંઘે છે.

B. (બી) ઇંગ્રેજી મૂળાક્ષરોનો બીજો અક્ષર. ઉચ્ચાર "બ"

C. (સી)ઇંગ્રેજી મૂળાઅક્ષરોનો ત્રીજો અક્ષર. એના સામાન્ય બે ઉચ્ચારછે. " ક્ " અને " સ્ " a, u, i, r, t, ની પૂર્વે અને છેડે એનો "ક્" ઉચ્ચાર થાય છે. અને e, i, v, ની પૂર્વે " સ્ " થાય છે. ch ના ચ્, છ, અને ષ્ એવા ત્રણ ઉચ્ચાર થાય છે. 100 પ્રાચીન રોમન લોકમાં સોનો આંકડો.

D. (ડી)ઇંગ્રેજી મૂળાક્ષરનો ચોથો અક્ષર, જ્યારે તેનો ધીમેથી અવાજ થાય છે ત્યારે તે " ડ્ " અથવા " દ્" બતાવે છે. અને જ્યારે જોરથી બોલાય છે ત્યારે "ધ્" થાય છે.

E. (ઇ) (ઇ, અ, એ) ઇંગ્રેજી મૂળાક્ષરનો બીજો સ્વર અને પાંચમો અક્ષર, ગુજરાતીમાં એનો અર્થ "ઇઃ" અથવા "એ" થાય છે.

F. (ઍફ્) ઇંગ્રેજી મૂળાક્ષરનો છઠો અક્ષર. એનો ઉચ્ચાર "ફ્"થાયછે.

G. (જી)ઇંગ્રેજી મૂળાક્ષરનો સાતમો અને વ્યંજનનો પાંચમો અક્ષર,એના

એ ઉચ્ચાર થાય છે. "ગ્" અને "જ્".

H. (એચ) ઇંગ્રેજી મૂળાક્ષરનો આઠમો અક્ષર. એનો ઉચ્ચાર "હ્" થાયછે.

I. (આઈ) ઇંગ્રેજી મૂળાક્ષરનો નવમો અક્ષર અને તે ગુજરાતીમાં "ઇ" અને "આઇ" થી દર્શાવવામાં આવે છે. "I" સંખ્યામાં તે એકને માટે વપરાય છે.

J. (જે) ઇંગ્રેજી મૂળાક્ષરનો દશમો અક્ષર, એનો અર્થ "જ્" થાય છે.

K. (કે) ઇંગ્રેજી મૂળાક્ષરનો અગીઆરમો અક્ષર, એનો અર્થ "ક્"થાયછે.

L. (એલ) ઇંગ્રેજી મૂળાક્ષરનો બારમો અક્ષર. 50 આંકની સંજ્ઞા તરીકે એ ૫૦ ને માટે વપરાય છે. એનો ઉચ્ચાર "લ" થાય છે.

M. (એમ) ઇંગ્રેજી મૂળાક્ષરનો તેરમો અક્ષર. સંખ્યામાં તે ૧૦૦૦ ના આંકડા તરીકે વપરાય છે.બરોબર ચોખંડા માથાનો ક્રાદરેટ "એમ્" તેના ઉચ્ચાર "મ" થાય છે.

N. (એન) ઇંગ્રેજી મૂળાક્ષરનો ચૌદમો અક્ષર છે એનો અર્થ ઞ, ણ, ન, ઙ. થાય છે.

O. (ઓ) ઇંગ્રેજી મૂળાક્ષરનો પંદરમો અક્ષર (o) પહેલાં તે ૧૧ના અર્થમાં વપરાતો હતો, તેના ઉપર આડી લીટી કરવાથી (o) તેનો આંક ૧૧૦૦૦ થતો અને તેનો કેટલેક સ્થળે એવો અર્થ થાય છે. અરે! ઓ! અરે અરે! રે! હો! હો હો! હાય હાય!

P. (પી) અંગ્રેજી મૂળાક્ષરનો સોળમો અક્ષર. એનો ઉચ્ચાર (પ્) થાયછે.

Q. (ક્યુ) ઇંગ્રેજી મૂળાક્ષરનો સતરમો અક્ષર. એનો ગુજરાતી ઉચ્ચાર "ક્વ" અગર 'ક્' થાય છે.

R. (આર) ઇંગ્રેજી મૂળાક્ષરનો અઢારમો અક્ષર. ગુજરાતીમાં એ-

નો ઉચ્ચાર "ર્" થાય છે, વાંચન, લેખન, અને ગણીત એ ત્રણને માટે વપરાતો વિનોદી શબ્દ પ્રયોગ. જેમકે (R) eading, (W) riting and (A) rithmetic.

S. (એસ) ઇંગ્રેજી મૂળાક્ષરનો ૧૯ મો અક્ષર તેના મુખ્ય ઉચ્ચાર બે છે. "સ" અને "ઝ" ઘણા શબ્દોનું બહુવચન કરવાને વપરાતો પ્રત્યય. ઇંગ્રેજી ક્રીયાપદનું ત્રીજા પુરૂષનું એક વચનાર્થ સુચક ક્રીયાપદ બનાવવામાં કામમાં આવતો પ્રત્યય, નામની છઠ્ઠી વિભક્તિના એકવચનનું રૂપ બતાવનાર પ્રત્યય.

T. (ટિ) ઇંગ્રેજી મૂળાક્ષરનો એકવીસમો અક્ષર. એનો ઉચ્ચાર ત્, થ્, ધ્, ટ્ અને ઠ્ એવા જુદા જુદા થાય છે.

U. (યુ) ઇંગ્રેજી મૂળાક્ષરનો એકવીસમો અક્ષર, તેના ત્રણ ઉચ્ચાર થાય છે, અ, યુ, ઉ દાખલા તરીકે Bub બબ્, Mule મ્યુલ્, Full ફુલ

V. (વિ) ઇંગ્રેજી મૂળાક્ષરનો બાવીસમો અક્ષર. તેનો ઉચ્ચાર વ થાય છે અને 5 પાંચના આંકડા તરીકે વપરાય છે.

W. (ડબલ્યુ) ઇંગ્રેજી મૂળાક્ષરનો તેવીસમો અક્ષર. ગુજરાતીમાં એનો ઉચ્ચાર "ઉવ્" થાય છે.

X. (એક્સ) ઇંગ્રેજી મૂળાક્ષરનો ચોવીસમો અક્ષર. ગુજરાતીમાં એના ઉચ્ચાર ક્સ, ગ્સ અને ઝ એવા ત્રણ ઉચ્ચાર થાય છે. આંકડાં તરીકે ૧૦ ને ઠેકાણે વપરાય છે.

Y. (વાઈ) ઇંગ્રેજી મૂળાક્ષરનો પચીસમો અક્ષર. એનો ઉચ્ચાર "યૂ" થાય છે.

Z. (ઝેડ્) ઇંગ્રેજી મૂળાક્ષરનો છવ્વીસમો અક્ષર. એનો ઉચ્ચાર "ઝ" થાય છે.

THE ROYAL CROWN PRIMER PART I.

ધિ રૉયલ ક્રાઉન પ્રાઇમર પાર્ટ ધિ ફ્રસ્ટ.

ધો રૉયલ ક્રાઉનુ પહેલી ભાગ ૧ લો.

Page 5 (પેઇજ. ધિ ફીફ્થ્) પાનું પાંચમું

નીચે લખેલા શબ્દોમાં O નો ઉચ્ચાર " ઓ " થાયછે. E નો ઉચ્ચાર "ઇ" થાયછે. "O" નો ઉચ્ચાર "ઑ" અને "ઉ" પણ થાયછે. અને A નો ઉચ્ચાર " એ " અને 'ઍ' થાય છે. અને I નો ઉચ્ચાર " ઇ " થાય છે. અને " U " નો ઉચ્ચાર " અ " થાય છે. અને " Y " નો ઉચ્ચાર " આઇ " થાય છે.

So (સો) એવું, એમ.
Go (ગો) જાઓ, જવું.
No (નો) ના, નહીં, કોઇ નહીં.
Lo (લો) જો, જુઓ.
Be (બી) થવું, હોવું.
Me (મી) મને, મારી. પહેલો પુરૂષ એકવચનનું બીજી વિભકતીનું રૂપ છે.
We (ઉવી)અમે, આપણે. પહેલો પુરૂષ બહુવચન.
He (હી) તે,(ત્રીજો પુરૂષ એકવચનનુ ત્રીજી વિભકતીનું રૂપ)

Ox (ઑકસ) બળદ,
Or (ઑર્) અથવા, કે.
On (ઑન્) ઉપર, આગળ.
Of (ઑફ્) નો,ની, નું, ના, નાં વિષે (છઠ્ઠી વિભકતીનો પ્રત્યય.)
As (ઍઝ) જેમ, તેથી, જવું.
At (ઍટ્) તરફ, આગળ.
Am (ઍમ્) છું.
An (ઍન્) એક, એકાદ. (આર્ટીકલ છે, માટે એનો અર્થ ઘણીજ જગ્યોએ થતો નથી).
Is (ઇઝ્) છે.

It (ઇટ્) તે. (નાન્યતર જાતી)
In (ઇન્) અંદર, માં.
If (ઇફ્) જો.
Us (અસ્) અમને, આપણને.
Up (અપ્) ઉપર.
To (ટુ) ને, પાસે.
Do (ડુ) કરવું.
By (બાય્) પાસે, પાસેથી. (પાંચમીનો પ્રત્યય છે.)
My (માય) મારૂં.
No (નો) ના, નહીં.
Yes (યસ) હા.

LESSON A* (લેશન એ) પાઠ ૧ લો.

I (આઇ) હું. (પહેલો પુરૂષ એકવચન.)

a. I am in (આઇ ઍમ્ ઇન્) હું અંદર છું.
b. Is he in? (ઇઝ હી ઇન્?) તે અંદર છે.?
c. He is in (હી ઇઝ ઇન્) તે અંદર છે.
d. We go in (ઉવી ગો ઇન્) અમે અંદર જઇએ છીએ.
e. I go up (આઇ ગો અપ્) અમે ઉપર જઇએ છીએ.
f. He is up (હી ઇઝ અપ્) તે ઉપર છે.
g. So he is (સો હી ઇઝ) તે એમ છે.
h. So am I (સો એમ્ આઇ) હું એમ છું.
i. Is it so? (ઇઝ ઇટ્ સો?) તે એમ છે?
j. It is so (ઇટ્ ઇઝ સો) તે એમ છે.
k. Go by me (ગો બાય મી) મારી પાસેથી જા.

---

*A બીજી ઘણી એક ચોપડીઓ No. 1. 2. 3. એવી રીતે શરૂઆત કરેછે પણ આ ચોપડીમાં તેવીજ રીતે નથી પણ છોકરાઓને વધારે ફાયાદો થાય માટે A, B. C. થી પાઠો શરૂઆત કરેલાં છે.

l. We go on (ઉવી ગો ઑાન્) અમે આગળ જઇએ છીએ.
m. Do we go? (ડુ ઉવી ગો?) અમે જઇએ.
n. Yes, go on (યસ, ગો ઑાન્) હા આગળ ચાલો.
o. On we go (ઑાન્ ઉવી ગો) અમે ઉપર જઇએ છીએ.
p. I am to go (આઇ એમ ટુ ગો) હું જવાનો છું.

Page the 6 (પેઇજ ધિ સીકથ) પાનુ ૬ઠું.

LESSON B. (લેશન બી) પાઠ બીજો.

b. I am up on an ox (આઇ એમ્ અપ્ ઑાન્ એન્ આકસ) હું એક બળદ ઉપર છું.
c. Lo! I am on my ox (લો! આઇ એમ્ ઑાન્ માય ઑાકસ્) જુઓ! હું મારા બળદ ઉપર છું.
d. It is to go in; so am I (ઇટ્ ઇઝ્ ટુ ગો ઇન્; સો ઍમ આઇ) તે અંદર જવાનો છે. એમ હું (જવોનો) છું.
e. No, my ox is to go on (નૅા, માય ઑાકસ ઇઝ ટુ ગો ઑાન્) ના, મારો બળદ ઉપર જવાનો છે.
f. Am I by my ox? (ઍમ્ આઇ બાય માય ઑાકસ્?) હું મારા બળદ પાસે છુ?
g. No, I am on it, so I am (નો, આઇ એમ્ ઑાન્ ઇટ્, સો આઇ એમ) ના હું તે ઉપર છું. એમ હું છું.
h. Is my ox to go in? (ઇઝ્ માય ઑાકસ્ ટુ ગો ઇન્?) મારો બળદ અંદર જવાનો છે?

i. Yes, it is to go in (યસ્, ઇટ્ ઇઝ ટુ ગો ઇન્) હા. તે અંદર જવાનો છે.

j. Go in, my ox; go in (ગો ઇન્, માય ઑક્સ; ગો ઇન્) અંદર જા, મારા બળદ, અંદર જા.

Page the 7 (પેઇજ ધિ સેવન્થ) પાનું સાતમું.

Ox (ઑક્સ) બળદ.
Fox (ફૉક્સ) લોંકડી.
Box (બૉક્સ) પેટી.
Ot (ઑટ્)આ શબ્દ, બીજા શબ્દોના ઉચ્ચાર શુધ થાય માટે આપેલો છે તેનો અર્થ કાંઈ થતો નથી.
Not (નૉટ્) નહીં. નથી.
Got (ગૉટ્) મળ્યું, મેળવ્યું.
Pot (પૉટ્) વાસણ, ઘડો.
Hot (હૉટ્) ગરમ.
Shot (સ્હૉટ્) બંદુકનો બ્હાર. ગોળી મારી.
At (ઍટ્) તરફ.

Cat (કૅટ્) બિલાડી. મીની.
Rat (રૅટ્) ઉંદર.
Mat (મૅટ્) સાદડી.
Hat (હૅટ્) ઉભી ટોપી.
That (ધૅટ્) પેલી. તે.

Is (ઇઝ) છે.
His (હીઝ) તેની, તેનો.
As (ઍઝ) જેવું. જેમ.
Has (હૅઝ) પાસે છે.
An (ઍન્) એક.
And (ઍન્ડ) અને.
He (હી) તે (નરજાતી.)
She (શી) તે. (નારીજાતી).
The (ધ) તે. (આર્ટીકલ છે).
This (ધીસ્) આ. (સર્વનામ).

LESSON the C. (લેસન ધ સી) પાઠ ત્રીજો.

c. An ox, a box, and a fox (ઍન ઑક્સ, ઍ બૉક્સ ઍન્ડ એ ફૉક્સ.) એક બળદ, એક પેટી અને એક લોંકડી.

d. Is the ox in the box? (ઇઝ ધ્ ઑાક્સ ઇન ધ બૉાક્ષ?) તે બળદ પેટીમાં છે. ?

e. The fox is in the box (ધ ફૉાક્સ ઇઝ ઇન્ધ બૉાક્ષ) તે લોંકડી તે પેટીમાં છે.

f. Is the fox to be shot? (ઇઝ્ ધી ફૉાક્સ્ ટુ બી સ્હૉાટ્?) તે લોંકડી મારવાની છે. ?

g. Yes, he is to be shot (યસ, હી ઇઝ ટુ બી શૉાટ્) હા, તે મારવાની છે.

h. Is he my fox? O no. (ઇઝ હી માય ફૉાક્સ? ઑા નો) તે મારી લોંકડી છે? અરે ના.

i. The box is my box (ધી બૉાક્ષ ઇઝ માય બૉાક્ષ) તે પેટી મારી પેટી છે.

j. Is this pot hot? yes (ઇઝ ધીસ પૉાટ્ હૉાટ્, ? યસ.) આ ઘડો ગરમ છે? હા.

k. He has a hat; so has she (હી હૅઝ એ હૅટ્; સો હૅઝ શી) તેની પાસે ટોપી છે. એવી તેણીની પાસે છે.

l. His hat is in that box (હીઝ હૅટ્ ઇઝ ઇન થૅટ્ બૉાક્ષ) તેની ટોપી તે પેટીમાં છે.

Page 8 (પેઇજ્ ધિ એઇટથ) પાનું ૮ મું.

LESSON D. (લેસન ડી.) પાઠ. ૪ થો.

Mat (મૅટ્) શાદડી.

Has got (હૅઝ ગૉાટ) પ-

કડયો હતો. મેળવ્યો હતો.

Is not (ઇઝ નૉાટ) નથી.

d. My cat is on the mat (માય કેટ્ ઇઝ ઑાન્ ધી મૅટ્) મારી બીલાડી બે સાદડી ઉપર છે.

e. Is she on the box? No (ઇઝ શી ઑાન ધ બૅાક્ષ ? નો) તે પેટી ઉપર છે. ? ના.

f. The box is on the mat (ધી બૅાકસ ઇઝ ઑાન્ ધી મૅટ્) તે પેટી સાદડી ઉપર છે.

g. Has my cat got a rat? (હૅઝ માય કૅટ્ ગૅાટ્ એ રૅટ્ ?) મારી બીલાડીએ ઉંદર મેળવ્યો છે. ?

h. Yes, she has got a rat (યસ, શી હૅઝ ગૅાટ્ એ રૅટ્) હા, તેણીએ ઉંદર મેળવ્યો છે.

i. My box is on the Mat (માયૂ બૅાકસ ઇઝ ઑાન્ ધી મૅટ્) મારી પેટી સાંદડી ઉપર છે.

j. The fox is not in it. (ધી ફૅાકસ ઇઝ નૅાટ્ ઇન ઇટ્) તે લોંકડી તેની અંદર છે.

k. Is that my hat? Yes (ઇઝ ધૅટ્ માઇ હૅટ્ ? યસ) તે મારી ટોપી છે ? હા.

l. My hat is in that box (માય હૅટ્ ઇઝ ઇન ધૅટ્ બૅાકસ) મારી ટોપી તે પેટીમાં છે.

m. It is not on the mat. (ઇટ્ ઇઝ નોટ્ ઑાન્ ધી મૅટ્) તે તે સાદડી ઉપર છે.

Page the 9 (પેઇજ ધિ નાઇન્થ) પાનું ૯ મું.

નીચે લખેલા શબ્દોમાં A નો ઉચ્ચાર "ઍ" થાય છે.

At (અટ્) તરફ.

Bat (બૅટ્) ચામાચેણુ (અથવા રમવાનું બૅટ્.

Fat (ફૅટ્) જાડું.

Sat (સૅટ્) બેઠો.

Pat (પૅટ્) થાબડવું.

Pat (પૅટ્) છોકરાનું નામ છે.

Ad (ઍડ) એનો મીનીંગ થતો નથી.

Bad (બૅડ્) ખરાબ. દુષ્ટ.

Lad (લૅડ્) છોકરો.

Had (હૅડ્) પાસે હતું.

Sad (સૅડ્) દીલગીર.

Mad (મૅડ્) ગાંડું

નીચે લખેલાં શબ્દોમાં E નો ઉચ્ચાર "એ" થાય છે.

Et (એટ્) એનો અર્થ થતો નથી.

Get (ગેટ્) મેળવવું.

Let (લેટ્) દો. દેવું.

Set (સેટ્) મુકવું, આથમવું, જોડી.

Wet (ઉવૅટ્) ભીનું.

Pet (પેટ્) પાળેલું. લાડકું.

Ed (એડ્) મીનીંગ થતો નથી.

Red (રેડ્) રાતો.

Led (લેડ્) દોર્યું.

Fed (ફેડ્) ખવડાવ્યું.

Ned (નેડ્) નામ છે, (છોકરાનું)

Shed (શેડ્) ઝુંપડું. છાપરું. છાપરી.

LESSON E (લેશન ઇ) પાઠ પાંચમો

e. Pat is a bad lad (પૅટ્ ઇઝ એ બૅડ્ લૅડ્) પેટ ખરાબ છોકરો છે.

f. Yes; is it not sad? (યસ; ઇઝ ઇટ્ નૉટ્ સૅડ્) હા; તે દીલગીરી ભરેલું નથી. ?

g. We had a pet cat. (ઉવી હૅડ્ એ પૅટ્ કૅટ્) અમારી પાસે પાળેલી બીલાડી હતી.

h. It sat by us on the mat (ઇટ્ સૅટ્ બાય અસ ઑન્ ધી મૅટ્) તે અમારી પાસે સાદડી ઉપર બેઠી.

i. Pat shot the pet cat (પૅટ્ સ્હૉટ્ ધી પેટ્ કૅટ્) પૅટે (નામના છોકરાએ) પાળેલી બીલાડીને ગોળી મારી.

j. Is Pat to get a bat? (ઇઝ પૅટ્ ટુ ગેટ્ એબૅટ્?) પૅટ્ એક બૅટ્ મેળવવાનો છે.?

k. No, Not if he is so bad (નો, નૉટ્ ઇફ્ હી ઇઝ સો બૅડ્) ના, જો તે એટલો બધો ખરાબ નથી.

l. Has he a hat? o yes (હૅઝ હી ઍ હૅટ્? ઑ યસ.) તેણી પાસે ઉભીટોપી છે? અરે હા.

m. That is an ox; is it mad? (ધૅટ્ ઇઝ ઍન ઑકસ; ઇઝ ઇટ્ મૅડ્?) તે એક બળદ છે; તે ગાંડો છે?

n. No, the ox is not mad (નો, ધ ઑકસ ઇઝ નૉટ્ મૅડ્) ના તે બળદ ગાંડો નથી.

LESSON F.

Ned (નૅડ્) નામ છે (છોકરાનું)
Let us go (લૅટ્ અસ ગો) અમને જવાદો.

Has Led (હૅઝ લેડ્) દોર્યો છે.
Get (ગેટ્) લેઈ આવવું. મેળવવું.

f. Ned has led the red ox (નેડ્ હૅઝ લેડ્ ધ રેડ્ ઑક્સ) તેણે તે રાતા બળદને દોર્યો છે.

g. He led it up to the shed. (હી લેડ્ ઇટ્ અપ્ ટુ ધી સેડ્) તેણે ઝુપડા સુધી દોર્યો.

h. Let us go to the shed (લેટ્ અસ ગો ટુ ધી સેડ્) અમને ઝુંપડા સુધી જવાદો.

i. The red ox is fat; Pat it (ધી રેડ્ ઑક્સ ઇઝ ફૅટ્ ? પૅટ્ ઇટ્) તે રાતો બળદ જાડો છે. તેને થાબડો.

j. Yes, Ned has fed it (યસ્, નેડ હૅઝ ફૅડ્ ઇટ્) હા, નેડે (છોકરાનું નામ છે) તેને ખવરાવ્યું છે.

k. Is it wet in the shed (ઇઝ ઇટ્ વૅટ્ ઇન ધી શેડ્ ?) ઝુંપડીમાં ભીનાશ છે. ?

l. If it is, do not go up (ઇફ્ ઇટ્ ઇઝ, ડુ નૉટ્ ગો અપ્) જો તેવું છે, તો ઉપર જતા નહીં.

m. Go and get my bet (ગો ઍન્ડ ગેટ માય બૅટ્) જાઓ, અને મારૂં બૅટ લાવો.

n. I set it up in the shed (આઇ સેટ્ ઇટ્ અપ ઇન ધ સેડ્) હું ઝુંપડામાં તે ઉપર બેઠો.

o. Ned is to get my bat (નેડ્ ઇઝ ટુ ગેટ્ માય બૅટ્) નેડ મારૂ બેટ મેળવવાનો છે.

Page 12 (પેઇજ્ ધી ટ્વેલ્વ્) પાનું બારમું.

An (ઍન્) એક (આર્ટીકલ) છે. તેથી તેનો અર્થ થતો નથી.

Ran (રૅન્) દોડ્યો.

Can (કૅન્) શકવું.

Man (મૅન્) માણસ.
Dan (ડૅન્) છોકરાનું નામછે.'ડૅન્'
En (એન્) અર્થ થતો નથી.
ઉચ્ચાર "એન્" કરવો.
Den (ડેન્) ગુફા
Hen (હેન્) મૂરઘી.
Fen (ફેન્) ભીની જગા.
Ben (બેન્) નામ છે. (છોકરાનું).
It (ઇટ્) તે. (નાન્યતર જાતી).
Bit (બીટ્) કરડચો. કડકો.

Sit (સીટ્) બેસવું.
Pit (પીટ્) ખાડો.
Hit (હીટ્) મારવું. ઠોકવું.
Id (ઇડ્) નો અર્થ થતો નથી પણ નીચેના શબ્દોનો ઉચ્ચાર બતાવવા વાપરેલું છે. (ઈડ્).
Bid (બીડ્) ફરમાવવું.
Did (ડીડ્) કર્યું.
Kid (કીડ્) બકરીનું બચ્ચું.
Hid (હીડ્) સંતાડયું.

LESSSN G (લેશન ધી જી.) પાઠ ૭ મો.

g. Dan shot a fox as he ran to his den (ડેન્ શૉટ્ એ ફૉકસ ઍઝ હી રેન્ ટુ હીઝ ડેન્) જેવો તે તેની ગુફા તરફ દોડ્યો તેવો ડૅને લોંકડીને ગોળાથી માર્યો.

h. The fox had his den in the fen (ધી ફૉકસ હેડ્ હીઝ ડેન્ ઇનિ ધ ફૅન્) તે લોંકડી તેની ગુફામાં ભીની જગ્યામાં હતી.

i. He ran to the shed to get a hen (હી રેન્ ટુ ધી શેડ્ ટુ ગેટ એ હૅન્) તે મુરઘી મેળવવાને ઝુપડી સુધી દોડ્યો.

j. The fox did not get a hen. (ધી ફૉકસ ડીડ નૉટ્ ગેટ એ હેન્) તે લોંકડીએ મૂરઘી મેળવી નહી.

k. Dan is a man; He shot the fox (ડૅન્ ઇઝ એ મૅન્; હી શૉટ્ ધ ફૉકસ) ડેન માણુસ છે. તેણે લોંકડી ને ગોળાથી મારી.

l. My red hen is in the shed (માય રેડ્ હૅન્ ઇઝ ઇન ધી શેડ્) મારી રાતી મરઘી ઝુંપડામાં છે.

m. My hen has to be fed by me (માય હેન્ હૅઝ ટુ બી ફૅડ્ બાય મી) મારી મુરઘીને મારી પાસે ખવડાવવામાં આવે છે.

n. Get my hat, and let us go (ગેટ્ માય હૅટ્, એન્ડ લેટ્ અસ ગો) મારી ટોપી મેળવવા દો, અને અમને જવાદો.

o. Let us get my box and set it in the shed (લૅટ્ અસ ગેટ માય બૉક્સ, એન્ડ સેટ ઇટ્ ઇન ધી શેડ્) અમને મારી પેટી લાવવા દો અને ઝુંપડીમાં તેને મુકવા દો.

p. My hen can sit in the box (માય હૅન્ કેન સીટ્ ઇન ધી બૉક્સ) મારી મુરઘી પેટીમાં બેશી શકશે.

LESSON the H (લેશન ધી એચ) પાઠ ૮ મો.

h. This is a pet kid that I got (ધીસ્ ઇઝ એ પેટ્ કીડ્ ધૅટ્ આઇ ગૅાટ્) જે હું લાવ્યો તે આ પાળેલું બકરાનું બચ્ચું છે.

i. Pat my pet kid; do not hit it (પૅટ્ માય પેટ્ કીડ્; ડુ નૅાટ્ હીટ્ ઇટ્) મારા પાળેલા બચ્ચાંને થાબડો. તેને મારતા નહીં.

j. A fox hid in the shed and bit it (એ ફૅાક્સ હીડ્ ઇન ધી શેડ્ એન્ડ બીટ્ ઇટ્) લોંકડીએ ઝુંપડીમાં સંતાડ્યું અને તેને કરડ્યું.

k. Dan shot the fox in that pit (ડૅન્ શૅાટ્ ધી ફૅાક્સ ઇન ધૅટ્ પીટ્) ડેને તે લોંકડીને તે ખાડામાં મારી.

l. Bid Ned go and get his bat (બીડ્ નૅડ્ ગો એન્ડ ગેટ્ હીઝ બૅટ્) નેડને જવાનું ફરમાવો, અને તેનું બેટ મેળવો.

m. He has hid his bat in the shed (હી હૅઝ હીડ્ હીઝ બૅટ્ ઇન ધી શેડ્) તેણે ઝુંપડામાં તેનું બૅટ સંતાડયું છે.

n. Let us go and get it•if we can (લેટ અસ ગો એન્ડ ગેટ્ ઇટ્ ઇફઉવી કૅન્) આમને જવાદો અને જો અ-મારાથી બની શકે તો મેળવવા દો.

o. Ned•is the lad that fed the ox (નૅડ્ ઇઝ ધી લેડ્ ધૅટ્ ફેડ્ ધી ઑાકસ) નેડ છોકરો છે કે જેણે બળદને ખ-વડાવ્યું.

p. My red hen is in that box (માય રેડ્ હેન્ ઇઝ ઇન ધૅટ્ બૅાકસ) મારી રાતી મુરઘી તે પેટીમાં છે.

q. My kid can-not sit in a box (માય કીડ્ કૅન નૅાટ્ સીટ્ ઇન એ બૅાક્ષ)મારી બકરીનું બચ્યું પેટીમાં બેસી શકતું નથી.

•Page 14 (પેઇજ ધી ફૅાર્ટીન) પાનું ૧૪ મું.

Ell (એલ) ઉચ્ચાર થાયછે. "એલ" નો અર્થ; કપડું મા-પવાનું માપ છે.

Bell (બેલ્) ઘંટ.

Fell (ફેલ્) પડયું.

Sell (સેલ) વેચવું,

Well (ઉવેલ્) કુવો.

Nell (નેલ્) નામછે.

Ill (ઇલ્) માઠું.

Will (ઉવીલ્) ભવીષ્ય કા-ળની નીશાની છે. અર્થ; મરજી.

Kill (કીલ્) મારવું.

Till (ટીલ્) જયાં સુધી.

Hill (હીલ્) ટેકરી.

Bill (બીલ્) ચાંચ.

Un (અન્) ઉચ્ચાર થાયછે.

Run (રન્) દોડવું.
Sun (સન્) સુરજ.
Bun (બન્) પૂરી.

Dun (ડન્) જાડો, માતો.
Gun (ગન્) તોપ, બંદુક.

LESSSN the I (લેશન આઇ.) પાઠ ૯ મો.

i. Bill is to run up to the hill (બીલ્ ઇઝ ટૂ રન આપ્ ટુ ધી હીલ્) બીલ ટેકરીની ટોચ સુધી દોડવાનો છે.

j. Ben and I will be in the shed (બેન્ એન્ડ આઇ ઉવીલ બી ઇન ધી શેડ્) બેન અને હું ઝુંપડામાં હોઇશ.

k. Nell will go up as well (નેલ ઉવીલ ગો અપ્ એઝ વેલ્) નેલ સારી પેઠે ઉપર જશે.

l. Nell can rup well up the hill (નેલ્ કેન્ રન્ વેલ અપ ધી હીલ.) નેલ ટેકરી સુધી સારી રીતે દોડી શકશે.

m. Bill ran to that pit, and hid (બીલ્ રેન ટુ ધેટ્ પીટ્, એન્ડ હીડ્) બીલ તે ખાડા સુધી દોડયો અને સંતાડયો.

n. Nell and I sat on the hill (નેલ એન્ડ આઇ સેટ્ ઑાન્ ધી હીલ) નેલ અને હું ટેકરી ઉપર બેઠો.

o. Dan has a gun; he shot the fox (ડેન્ હેઝ એ ગન્; હી શોટ્ ધી ફૉકસ)ડેન્ પાસે બંદુક છે; તેણે લોંકડીને ગોળીથી મારી.

p. Did he kill the fox ? Yes (ડીડ્ હી કીલ ધી ફૉકસ ? યસ) તેણે તે લોંકડીને મારી ? હા.

q. Did Dan can sell the fox ? O no (ડીડ્ ડૅન્ કેન્ શેલ્ ધી ફૉકસ ? ઓ નૉ) ડૅન્ લોંકડીને વેચી શકયો ? અરે, ના.

A bad fox will kill a hen or a kid (એ બેડ્ ફૉકસ ઉવીલ કીલ્લ એ હેન્ ઑર એ કીડ્) એક ખરાબ લોંકડી મૂરધી અથવા તેનાં બચ્ચાંને મારી ખાશે.

Page 15 (પેઇજ ફીફ્ટીન) પાનું પંદરમું.

LESSON the J. (લેશન્ ધી જે.) પાઠ ૧૦ મો.

Did tell (ડિડ્ ટેલ) કહ્યું.
Dan (ડૅન્) છોકરાનું નામ છે. (ડૅન્)
That (ધૅટ્) કે.
Bill (બીલ) છોકરાનું નામ છે.
Ill (ઇલ્લ) માંદો.
Had to be fed ખવરાવવું પડયું.
Dun (ડન્) ઝાંખા રંગનો.
Run (રન્) દોડવું.
Bun (બન્) રોટલી.
Hill (હીલ્લ) ટેકરી.

Red (રેડ્) રાતો.
Shed (શેડ્) ઝુંપડી.
Led (લેડ્) દોર્યો.
Fell (ફેલ્લ) પડયો.
Into (ઇન્ટુ) માં, અંદર.
Till (ટીલ) જયાં સુધી.
Got fat (ગોટ્ ફૅટ) જાડો થયો.
Bell (બેલ્લ) ઘંટ.
Let run (લેટ્ રન્) દોડી જવા દો.

J. Did not Dan tell me that Bill is ill? (ડીડ નૉટ્ ડૅન્ ટેલ્લ મી ધૅટ્ બીલ ઇઝ ઇલ્લ ?) ડૅન મને કહેતો નહોતો કે બીલ માંદો છે. ?

A. Yes, it is sad; Bill is not well. (યસ્ ઇટ ઇઝ

સેડ્; બીલ ઇઝ નૉટ વૅલ્) હા, તે દીલગીર છે. બીલ સારો નથી.

l. The Dun ox had to be fed (ધી ડન્ ઑક્સ હેડ્ ટુ બી ફેડ્) તે માંદા બળદને ખવરાવવું પડ્યું.

m. As Bill led it, he fell in–to a pit (ઍઝ્ બીલ લેડ્ ઇટ્, હી ફેલ ઇન ટુ એ પીટ્) જેવો બીલે તેને દોર્યો, તેવોજ તે ખાડામાં પડ્યો.

n. That will not kill the lad (ધેટ્ ઉવીલ્ નૉટ્ કીલ્ ધી લેડ્) તે છોકરાને મારશે નહી.

o. Run and get a bun for Bill (રન્ ઍન્ડ ગેટ્ એ બન્ ફૉર્ બીલ્) દોડો અને બીલ વાસ્તે રોટલી મેળવો.

p. The dun ox is up on the hill (ધી ડન્ ઑક્સ ઇઝ અપ ઑન ધી હીલ્) તે માંદો બળદ ટેકરી ઉપર છે.

q. The Red ox is in the shed (ધી રેડ્ ઑકસ ઇઝ ઇન ધી શેડ્) તે રાતો બળદ ઝુંપડામાં છે.

r. Bill fed the ox till he got fat (બીલ ફેડ્ ધી ઑક્સ ટીલ હી ગૉટ્ ફેટ્) જ્યાંસુધી તે જાડો થયો ત્યાંસુધી બીલે બળદને ખવડાવ્યું.

s. That is the bell; Let us run in to Bill (ધેટ્ ઇઝ ધ બૅલ્; લેટ્ અસ રન્ ઇન ટુ બીલ) તે ઘંટ છે. અમને બીલ્ પાસે દોડી જવા દો.

Page 17 (પેઇજ સેવનટીન્) પાનું સતરમું.

નીચેના શબ્દમાં E નો ઉચ્ચાર "એ" થાય છે.

Eg (એગ્) આ શબ્દનો અર્થ થતો નથી પણ નીચેના શબ્દનો શુદ્ધ ઉચ્ચાર થાય માટે વાપરેલો છે.
Beg (બેગ્) માગવું, વિનંતી કરવી.
Peg (પેગ્) ખુંટી.
Leg (લેગ્) પગ.
Ig (ઇગ્) નો અર્થ થતો નથી.
Big (બીગ્) મોટો.
Pig (પીગ્) ડુક્કર.
Dig (ડીગ્) ખોદવું.
Og (ઑગ્) એનો અર્થ થતો નથી.
Bog (બોગ્) ખાબોચીયું, ભીની જગ્યા.
Hog (હૉગ) ડુક્કર.
Dog (ડૉગ્) કુતરો.
Ug (અગ્) એનો અર્થ થતો નથી.
Rug (રગ્) કામળી.
Pug (પગ્) વાંદરાના જેવા નાક વાળો.
Dug (ડગ્) ખોદયું.
Egg (એગ્) ઇંડું.
Off (ઑફ્) દૂર.

LESSON K. (લેશન કે) પાઠ ૧૧ મો.

Pet (પેટ્) પાળેલો.
As well as (ઍઝ ઉવેલ ઍઝ) માફક.
So well (સો વેલ) એટલી બધી સારી રીતે.
Let us run off (લેટ્ અસ રન ઑફ્) અમને દોડી જવા દો.
Run off (રન્ ઑફ્) દોડી જઇએ.
Wet (ઉવેટ્) ભીંજાવેલો.
By us (બાય અસ્) આપણી પાસે.
Got it (ગોટ્ ઇટ્) તે મેળવ્યું.

k. This is my pet pug dog (ધીસ ઇઝ માય પેટ્ પગ ડૉગ) આ મારો પાળેલો વાંદરા જેવો નાકવાળો કુતરો છે.

l. It can run as well as a cat (ઇટ્ કેન્ રન્ એઝ વેલ એઝ એ કેટ્) તે બીલાડીની માફક દોડી શકશે.

m. A pig can-not run so well as a dog (એ પિગ્ કેનનૉટ રન સો ઉવેલ એઝ એ ડૉગ) ડુક્કર કૂતરાની માફક દોડી શકશે નહીં.

n. Dan has a big pig in his shed (ડૅન્ હૅઝ એ બીગ પીગ ઇન હીઝ શેડ્) ડેન પાસે તેના ઝુંપડામાં મોટો ડુક્કર છે.

o. A hog is a big pig, is it not? (એ હૉગ્ ઇઝ એ બીગ પીગ્ .ઇઝ ઇટ નૉટ?) ડુક્કર મોટો ડુક્કર છે. તે નથી?

p. Let us run of to the bog (લેટ્ અસ રન ઑફ ટુ ધી બૉગ્) અમને ખાબોચીઆ સુધી દુર દોડવા દો.

q. A bog is a wet fen, as it not? (એ બૉગ્ ઇઝ એ વેટ્ ફેન, ઇઝ ઇટ્ નૉટ ?) ખાબોચીયું ભીનાએલી જગ્યા છે. કેમ તે નથી ?

r. We can go in and sit on the rug (ઉવી કૅન્ ગો ઇન ઍન્ડ સીટ્ ઑાન ધી રગ્) અમે અંદર જઇએ છીએ. અને કામળ ઉપર બેસીએ છીએ.

s. My pug dog can sit by us on the rug (માય પગ્ ડોગ્ કૅન્ સીટ બાય અસ ઑાન્ ધી રગ્) મારો વાંદરાના જેવો નાકવાળો કુતરો કામળ ઉપર મારી પાસે બેસી શકે છે.

t. His leg is wet; he got it wet in the bog (હીઝ

લેગ્ ઇઝ ઉવેટ્; ધી ગોટ હૅડ્ ઉવેટ ઇન ધી બૉગ્) તેનો પગ ભીંજાગેલો છે. તે ખાબોચીયામાંથી ભીનો લાવ્યો.

LESSON L (લેશન ધી એલ) પાઠ. ૧૨ મો.

Pit (પીટ્) ખાડો.
Egg (એગ્) ઇંડું.
Get off (ગેટ ઑફ્) ઉ: તારવાને.

So big as this (સો બી-ગ એઝ ધીસ) આના જે-ટલું મોટું.

l. Dan is to dig a big pit (ડૅન્ ઇઝ ટુ ડીગ્ અ બીગ પીટ્) ડેન એક મોટો ખાડો ખોદવાનો છે.

m. We can sit by Dan till the pit is dug (ઉવી કૅન્ સીટ્ બાય ડૅન્ ટીલ ધ પીટ ઇઝ ડગ્) જ્યાંસુધી ખાડો ખોડાય છે. ત્યાંસુધી અમે ડેન પાસે બેસી શકીશું.

n. Beg Nell to get my hat off the peg (બેગ્ નેલ ટુ ગેટ્ માય હૅટ્ ઑફ્ ધી પેગ) મારી ટોપી ખુટી ઉપરથી લાવવાને નેલને વિનંતી કરો.

o. She can sit by us at the pit (શી કૅન્ સીટ્ બાય અસ્ એટ ધી પીટ્) તે ખાડા ભણી અમારી પાસે બેશી શકશે.

p. Dan shot the red fox in a pit (ડૅન્ શૉટ્ ધ રેડ ફૉક્સ ઇન્ એ પીટ્) ડૅને ખાડામાં લાલ લોંકડીને ગોળીથી મારી.

q. That pit is not so big as this (ધેટ્ પીટ્ ઇઝ નૉટ્ સો બીગ્ એઝ ધીસ્) તે ખાડો આના જેટલો એટલો

બધો મોટો નથી.

r. Ben got an egg in the shed (બેન્ ગૉટ્ ઍન એગ્ ઇન ધી શેડ્) બેન ઝુપડામાં ઇંડું લાવ્યો.

s. Will Ben sell me his hen? No. (ઉવીલ બેન્ સેલ્ મી હીઝ હેન્ ? નો) બેન તેની મુરગી મને. વેચાતી આપશે ? ના.

t. Run and beg Ben to do so (રન્ ઍન્ડ બેગ્ બેન્ ટુ ડુ સો.) દોડો અને એમ કરવાને બેનને વિનંતી કરો.

u. He is to sell his hen to Dan (હી ઇઝ ટુ સેલ હીઝ હેન્ ટુ ડેન્) તે તેની મુરઘી ડેનને વેચવાનો છે.

Page 19 (પેઇજ નાઇન્ટીન્થ) પાંનું ઓગણીમું.

(Words not used in the reading Lessons).
વાંચન પાઠોમાં નહીં વપરાયેલા શબ્દો.

નીચે લખેલા શબ્દોમાં A નો ઉચ્ચાર. "ઍ" થાય છે.
Cab (કૅબ્) બે અથવા ચાર પૈડાની ગાડી.
Crab (ક્રૅબ) ચીડીઉ માખુસ; કાચબો.
Grab (ગ્રેબ્) પકડવું, ઝાલવું.
Stab (સ્ટેબ) ભોંકવું.
Am (ઍમ્) છું.
Jam (જેમ્) મુરબ્બો.
Ham (હૅમ્) ડુક્કરની જાંગ.
Ram (રૅમ્) મેંઢો.

Words (વર્ડ્ઝ) શબ્દો.
Not used in (નોટ યુઝ્ડ ઇન) માં નહી વપરાયેલા.
Reading (રીડીંગ) વાંચન.
Lessons (લેશન્સ) પાઠો.
Exercises (એક્સરસાઇઝીઝ) અભ્યાસ પાઠો.

Cram (ક્રૅમ્) અકરાંયાંતીઆ-
પણે ખાવું.
Sham (શૅમ્) ઠગાઇ.
Ag (ઍગ્) નો મીનીંગ થ-
તો નથી.
Bag (બૅગ્) કોથળી.
Lag (લૅગ્) રસળવું.
Flag (ફ્લૅગ) વાવટો.
Nag (નૅગ્) ટટુ.
Rag (રૅગ્) ચીથરૂ.
Drag (ડ્રૅગ્) ખેંચવું.
Stag (સ્ટૅગ) સાબર.
Ap (ઍપ્) નો ઉચ્ચાર થ-
તો નથી.
Cap (કૅપ્) ટોપી.
Gap (ગૅપ્) બાકુ.
Hap (હૅપ્) નશીબ.
Lap (લૅપ્) ચાટવું.
Map (મૅપ્) નકશો.
Nap (નૅપ્) ઉંધ.
Rap (રૅપ્) ટકોરો મારવો.
Sap (સૅપ્) રસ.
Tap (ટૅપ્) રેસકી.
Trap (ટ્રૅપ્) કોળવાઇ.

Strap (સ્ટ્રૅપ્) પાટો.
નીચે લખેલા શબ્દોમાં A નો
ઉચ્ચાર "આ" થાય છે.
Ar (આર્) "આર" નો
મીનીંગ થતો નથી.
Bar (બાર) સળીઓ.
Car (કાર) ગાડી.
Far (ફાર્) દૂર.
Mar (માર) બગાડવું, નુક-
શાન કરવું.
Tar (ટાર) ભાર, ડામર.
Star (સ્ટાર) તારો.
નીચે લખેલા શબ્દોમાં O નો ઉ-
ચ્ચાર "ઑ" થાય છે.
Ob (ઑબ્) નો મીનીંગ થ-
તો નથી.
Bob (બૉબ્) લટકવું.
Cob (કૉબ) ટોચ.
Fob (ફૉબ) ઘડીઆળ મુ-
કવાનું ગજવું.
Hob (હૉબ) ગામડીઓ.
Job (જૉબ્) પરચુરણ કા-
મો, ઉધડ કામ.
Mob (મૉબ્) ટોળું.

Rob (રૉબ્) લુંટવું.
Sob (સૉબ્) ડસકું.
નીચે લખેલા શબ્દોમાં Uનો
ઉચ્ચાર " અ " થાય છે.
Ud (અડ્) "અડ" નો ઉ-
ચ્ચાર થતો નથી.
Bud (બડ્) કળી.
Cud (કડ્) વાગોળેલો પદાર્થ.
Mud (મડ્) કાદવ.
Stud (સ્ટડ્) ખોરીઉ.
Bur (બર્) કાંટવાળુ કાટલું.
Cur (કર્) હલકા જાતનો
કૂતરો.
Fur (ફર્) રૂઆં.
Purr (પર્) મીઆંઉ મી-
આંઉ કરવું.
નીચે લખેલા શબ્દોમાં O નો
ઉચ્ચાર " ઑ " થાય છે.
Fop (ફૉપ) છાંકડો.
Hop (હૉપ્) કુદવું.
Lop (લૉપ્) ઝુકો, કાપવું.
Mop (મૉપ્) કુચડો, કુચો.
Pop (પૉપ્) ફૂટવું, અવાજ
થવો.
Sop (સૉપ્) પલાળવું.
Top (ટૉપ્) મથાળુ.
Stop (સ્ટૉપ્) બંધ કરવું.
Shop (શૉપ્) દુકાન.
Chop (ચૉપ્) માંસનો કકડો.
Crop (ક્રૉપ્) પાક.
Drop (ડ્રૉપ) મુકવું.
નીચે લખેલા શબ્દોમાં U નો
ઉચ્ચાર " અ " થાય છે.
Gum (ગમ્) ગુંદર.
Hum (હમ્) ગણગણવું.
Sum (સમ્) હીસાબ, રકમ.
Rum (રમ્) રમ જાતનો દારૂ.
Drum (ડ્રમ્) ઢોલ.

Page the 20 (પેઇજ્ ધી ટ્વેન્ટીએથ) પાનું વીસમું.

Ass (ઍસ) ગધેડો.
Lass (લૅસ) છોડી.
Mass (માસ) ઢગલો.
Pass (પૅસ) રસ્તો.
Grass (ગ્રાસ) ઘાસ.
Ash (ઍશ) રાખ.

Cash (કૅસ) ધંડાકો.
Dash (ડૅસ) ધસવું.
Gash (ગૅસ) ઘા.
Lash (લૅસ્) ચાબુક.
Rash (રૅશ્) તોછડો.
Sash (સૅશ) શોભીતો પટ્ટો.
Asp (ઍસ્પ) એક જાતનો ઝેરી સાપ.
Gasp (ગૅસ્પ) હાપવું.
Rasp (રૅસ્પ્) કાનસ.
Grasp (ગ્રૅસ્પ) ઝુટવી લેવું.
Clasp (કલૅસ્પ્) જોડવું.
Ard (આર્ડ) નો અર્થ થતો નથી.
Bard (બાર્ડ) ભાટ.
Card (કાર્ડ) પત્ર. પીંજવું.
Hard (હાર્ડ) સખત.
Lard (લાર્ડ) ચરબી..
Yard (યાર્ડ) વાર.
Art (આર્ટ) હુનર. કળા.
Cart (કાર્ટ) ગાડું.
Dart (ડાર્ટ) ફેંકવું.
Hart (હાર્ટ) સાબર.

Mart (માર્ટ) બજાર.
Part (પાર્ટ) ભાગ.
Start (સ્ટાર્ટ) નીકળવું.
Ath (એથ) નો મીનીંગ થતો નથી.
Bath (બૅથ) નાહવું.
Hath (હૅથ) પાસે છે.
Lath (લૅથ) ફાંસ, ગટ્ટો.
Path (પાથ) રસ્તો.
Carp (કાર્પ) એક જાતની માછલી.
Harp (હાર્પ) સારંગી.
Arch (આર્ચ) કમાન.
Larch (લાર્ચ) લાકડાનું નામ છે, (લાર્ચ).
Parch (પાર્ચ) સુકવવું.
Starch (સ્ટાર્ચ) કાંજી, આર, ખેલ.
Barn (બાર્ન) કોઠાર.
Darn (ડાર્ન) તુણવું.
Yarn (યાર્ન) સુતર.
Ark (આર્ક) કમાન.
Bark (બાર્ક) ભસવું.
Dark (ડાર્ક) અંધારૂં.

Hark (હાર્ક) સાંભળવું.
Lark (લાર્ક) ચંડોળ પક્ષી.
Park (પાર્ક) બાગ.
Camp (કૅમ્પ) છાવણી.
Damp (ડૅમ્પ) ભીનું.
Lamp (લૅમ્પ) દીવો.
Stamp (સ્ટૅમ્પ) ઠોકવું.
Tramp (ટ્રૅમ્પ) ખુંદવું. કચડવું.
Bump (બમ્પ) ઠુંસો, મુકો, ગુસ્સો.

Hump (હમ્પ) ખુંધ.
Jump (જમ્પ) કુંદવું.
Lump (લમ્પ) લોંદો.
Clump (કલમ્પ્) જથ્થો.
Pump (પમ્પ) ઝંઓ.
Stump(સ્ટમ્પ્) ઠુંઠું. (ક્રીકેટની અંદર રમવાનાં સ્ટમ્પ"
Urn (અર્ન) નો મીનીંગ થતો નથી.
Burn (બર્ન) બાળવું.
Turn (ટર્ન) ફેરવવું.

Page 21 (પેઇજ ટ્વેન્ટી ફર્સ્ટ) પાનું ૨૧ મું.

Dim (ડીમ્) ઝાંખો.
Rim (રીમ્) કોર.
Cub (કબ્) શિયાળ.
Rub (રબ્) ઘસવું.
Tub (ટબ્) પીપ.
Cup (કપ્) પ્યાલું.

Pup (પપ્) કુરકુરીયું.
Sup (સપ્) વાળુ.
But (બટ્) પણ.
Cut (કટ્) કાપવું.
Hut (હટ્) ઝુંપડું.
Have (હેવ્) પાસે છે.

Lesson M. (લેશન ઍમ્) પાઠ ૧૩ મો.

Hut (હટ્) ઝુંપડું.
Shed (શેડ્) ઝુંપડી, નાનુંઘર.
As bis as (ઍઝ બીઝ ઍઝ) જેટલું મોટું

Bun (બન્) પૂરી.
Bell (બૅલ્) ઘંટ.
Sun (સન્) સુરજ.
Hill (હીલ્) ટેકરી.

Will get (ઉવીલ ગેટ્)મેળવશે.
Red (રેડ્) રાતું.
Rub (રબ્) ઘસવું.

It Has (ઇટ્ હેઝ) તેને છે.
Set (સેટ્) મુકયું. (૨) અસ્ત પામ્યું.

m. Dan has a hut up on the hill (ડૅન્ હૅઝ એ હટ્ અપ્ ઑન્ ધ હીલ્) ડૅનનું ટેકરી ઉપર ઝુંપડું છે.

n. Is it as big as the shed ? O. no. (ઇટ્ ઇઝ્ ઍઝ બીગ ઍઝ ધ શેડ્ ?) તે ઝુંપડી જેટલું મોટું છે ? અરે, ના.

o. Ben and I can go up to the hut (બેન્ એન્ડ આઇકૅન્ ગો અપ્ ટુ ધ હટ્) બેન અને હું ઝુંપડા સુધી ઉપર જઇ શકીશું.

p. If Bill is well, let him go up. (ઇફ્ બીલ્ ઇઝ ઉવેલ્, લેટ હીમ્ ગો અપ્) જો બીલ સારો છે. તેને ઉપર જવાદો.

q. Cut up a bun for my pup. (કટ્ અપ્ એ બન્ ફૉર માય પપ્) મારા બચ્ચાં સારૂ રોટલી કાપો.

r, Will he get it in a cup,? no. (ઉવીલ હી ગેટ્ ઇટ્ ઇન એ કપ્ ? નૉ,) તે પ્યાલામાં મેળવશે ? ના.

s. That is my cup; It has a dim red rim. (ધૅટ્ ઇઝ માય કપ્, ઇટ હેઝ એ ડીમ્ રેડ્ રીમ્) તે મારૂં પ્યાલું છે. તેને ઝાંખી રાતી કોર છે.

t. Rub it; and set it up in the hut. (રબ્ ઇટ્, ઍન્ડ સેટ્ ઇટ્ અપ્ ઇન્ ધ હટ્) તેને ઘસો, અને ઝુંપડામાં તેને ઉપર મુકો.

u. We are to go in; the sun has set. (ઉવી આર્ ટુ ગો ઇન્, ધ સન્ હેઝ સેટ્) અમે અંદર જવાના છીએ; સૂરજ અસ્ત પામ્યો છે.

v. That is the bell; Let us go in and sup. ધૅટ્ ઇઝ ધ બૅલ, લેટ્ અસ ગો ઇન ઍન્ડ સપ્) તે ઘંટ છે. અમને જવા દો. અને વાળુ કરવા દો.

Lesson N. (લેશન્ ધી ઍન્) પાઠ ૧૪ મો.

n. The pig is to be fad in shed. (ધી પીગ ઇઝ ટુ બી ફેડ્ ધી શેડ્) તે ડુક્કરને ઝુંપડામાં ખવરાવવાનું છે.

o. The pig has a big tub, (ધી પીગ્ હૅઝ એ બીગ્ ટબ્) તે ડુક્કર પાસે મોટો પીપ છે.

h. It is a big cup for the pig. (ઇટ્ ઇઝ એ બીગ્ કપ્ ફૅાર ધી પીગ્) તે ડુક્કર વાસ્તે મોટો પ્યાલો છે.

q. A rat sat by the pig in his tub. (એ રૅટ્ સેટ્ બાય ધ પીગ્ ઇન હીઝ ટબ્) ઉંદર પીપમાં ડુક્કર પાસે બેઠો.

r. Dan will have to get a cut. (ડેન્ ઉવીલ હૅવ્ ટુ ગેટ્ એ કૅટ્) ડેન બીલાડી મેળવવાનો હશે.

s. The cat will run. and kill it. (ધી કૅટ્ ઉવીલ રન્, એન્ડ કીલ્ ઇટ્) બીલાડી દોડશે અને તે મારશે.

t. A pig is to be fed but not a rat. (એ પીગ્ ઇઝ ટુ બી ફૅડ્, બટ્ નૉટ એ રૅટ્) ડુક્કરને ખવડાવવાનું છે. પણ ઉંદર નથી.

u. If it is fat, Dan can sell it. (ઈફ્ ઇટ્ ઇઝ ફૅટ્, ડૅન કૅન્ સેલ્ ઇટ્) જો તે જાડો છે તો ડૅન તેને વેચીશકશે.

v. Dan has the cub of a fox. (ડૅન્ હૅઝ ધ કબ્ ઑફ્ એ ફૉક્ષ) ડેન પાસે લોંકડીનું બચ્ચું છે.

w. He got it in the den of a fox (હી ગૉટ્ ઇટ્ ઇન ધી ડેન ઑફ્ એ ફૉક્ષ.) તેણે લોંકડીની ગુફામાં તે મેળવ્યું.

Page 23 (પેઈજ ટુવીન્ટી થ્રી.) પાનું ૨૩ મું.

Ut (અટ્) નો મીનીંગ થતો નથી.
Nut (નટ્) નાળીએળ.
Rut (રટ્) ચીલો.
Shut. (સટ્) બંધ કરવું.
Od (ઑડ) નો મીનીંગ થતો નથી.
Rod (રૉડ્) રસ્તો.
Cod (કૉડ)માંછલીની જાતછે.
Sod (સૉડ્) ઘાસના જમીન સાથે મળેલાં મૂળીઆં.
In (ઇન્) અંદર.

Fin (ફીન્)પાંખ (માછલીની
Pin (પીન્) ટાંકણી.
Tin (ટીન) કલાઇ.
Dip (ડીપ્) ઉંડું.
Sip (સીપ્) આચમન કરવું. ચાટવું
Lip (લીપ્) હોઠ.
Dish (ડીસ્) રકાબી.
Fish (ફીસ્) માંછલી.
Wish (ઉવીસ્) ઇચ્છા.
With (ઉવીથ્) સાથે.

Lesson the O (લેશન ધ ઓ) પાઠ. ૧૫ મો.

a. I have a tin Dish for my pup. (આઇ હૅવ એ ટીન ડીશ્ ફૉર્ માય પપ્) મારી પાસે મારા કુકરીયાં સારૂં કલાઇની રકાબી છે.

p. He will not dip his lip in it. (હી ઉવીલ્ નૉટ્ ડીપ્ હીઝ લીપ્ ઇન ઇટ્) તે તેની અંદર તેની ચાંચ બોળશે નહીં.

q. A dog can not sip from a cup. (એ ડૉગ્ કૅનનૉટ્ સીપ્ ફ્રૉમ એ કપ્) કૂતરો પ્યાલામાંથી ચાટી શકશે નહીં.

r. The hog is shut in the shed. (ધી હોગ્ ઇઝ સટ્ ઇન ધી શેડ્) તે ડુક્કર ઝુંપડામાં બાંધેલું છે.

s. Dan got a pin to shut the shed with. (ડૅન્ ગૉટ્ એ પીન ટુ સટ્ ધ શેડ્ ઉવીથ) ડૅને ઝુંપડી બંધ કરવાને ટાંકણી મેળવી.

t. I wish the pig to get this nut. (આઇ ઉવીસ ધપીગ્ ટુ ગેટ્ ધીસ નટ્) હું નાળીએર મેળવવાને ડુક્કરને ચાહુંછું.

u. It fell and hit me as I sat on the sod (ઇટ્ ફૅલ્ એન્ડ હીટ્ મી એઝ આઇ સેટ્ ઓન ધ સોડ્) જેવોજ હું માટીના ઢેપા ઉપર બેઠો તેવુંજ તે પડ્યું અને મને વાગ્યું.

v. It did not cut me; it is not big. (ઇટ્ ડીડ નૉટ કટ્ મી; ઇટ્ ઇઝ નૉટ બીગ્) તેને મને કાપ્યું નહીં; તે મોટું નથી.

w. The pig can have this nut, (ધ પીગ કૅન્ હૅવ્ ધીસ નટ્) તે ડુક્કરને આ નાળીએર મળશે.

o. Dan will wish his pig to get fat, so that he can sell it. (ડૅન ઉવીલ્ વીશ હીઝ પીગ ટુ ગેટ્ ફૅટ્, સો ધૅટ્ હી કૅન્ સેલ્ ઇટ્) ડૅન તેનું ડુક્કર જાડુ થવાને ચાહશે, જેથી તે તેને વેચી શકશે.

LESSON P. (લેશન પી) પાઠ ૧૬ મો.

Bill (બીલ) નામ છે.
Rod (રૅાડ્) શળીઓ.
To fish (ટુ ફીશ્) માછલી પકડવાને.
Rut (રટ) જનાવરોનું મૈથુન. (૨) ચીલો.
Cod (કૅાડ્) માછલીની જાત છે. Cod "કૅાડ"
Wet (ઉવેટ્) ભીજાવેલી.
Fin (ફીન્) માંછલીની પાંખ.

p. Bill has got a rod to fish with (બીલ્ હૅઝ ગૅાટ્ એ રૅાડ્ ટુ ફીશ ઉવીથ) બીલ પાસે માંછલી પકડવાને સળીઓ છે.

q. Bill fell in a rut on the hill (બીલ્ ફૅલ ઇન એ રટ્ ઑાન્ ધ હીલ્) બીલ ટેકરી ઉપર ચીલામાં પડયો.

r. He cut his leg, but he has got well (હી કટ્ હીઝ લેગ્ બટ્ હી હૅઝ ગૅાટ ઉવૅલ્) તેણે તેનો પગ કાપ્યો. પણ તે સારો થયો છે.

s. We can sit on the sod and fish (ઉવી કૅન્ સીટ્ ઑાન ધી સૅાડ્ ઍન્ડ ફીશ્) અમે જમીનના ઢેપા ઉપર અને માંછલી ઉપર બેસી શકીશું.

t. Bill has got a fish on his rod (બીલ્ હૅઝ ગૅાટ્

એ ફીશ્ ઑાન ધીઝ શૅાડ્) બીગે તેના કાળીઆ ઉપર ગંછેલી મેળવી છે.

u. It is not a big fish, is it a cod (ઇટ્ ઇઝ નૉાટ્ એ બીગ ફીશ્, ઇઝ ઇટ્ એ કૉાડ) તે એકમોટું માંછલું નથી, તે કોડ નાગની માંછલી છે.

v. No, No, a cod is a big fish (નૉા, નૉા, એ કૉાડ્ ઇઝ એ બીગ્ ફીશ્) ના, ના, કોડ એ મોટી માંછલી છે.

w. This fish has got a red fin (ધીસ ફીશ હૅઝ ગૉાટ્ એ રૅડ્ ફીન્) આ માંછલીને રાતી પાંખઆવી છે.

x. Run and get a dish for the fish (રન્ ઍન્ડ ગેટ્ એ ડીશ્ ફૉાર ધી ફીશ) દોડો અને માંછલીને વાસ્તે રકાબી મેળવો.

y. Set the dish in the shed, the fish is wet (સેટ્ ધી ડીશ્ ઇન્ ધી શૅડ્, ધી ફીશ્ ઇઝ ઉવૅટ્) રકાબી છાપરામાં મુકો. માંછલી ભીંજાયેલી છે.

Page 25. (પેજ / ધી ટ્વૅન્ટી ફીફ્થ) પાનું પચીસમું.

End (ઍન્ડ) છેડો.
Bend (બેન્ડ) વળવું.
Send (સેન્ડ) મોકલવું.
And (ઍન્ડ) અને.

Sand (સૅન્ડ) રેતી.
Ent (ઍન્ટ) ને મીનીંગ થતો નથી.
Bent (બેન્ટ) વળેલું.

Lend (લેન્ડ) ઉછીનું આ-
પવું.
Mend (મૅન્ડ) ઘડવું.
Rend (રેન્ડ) ફાડવું.
Hand (હૅન્ડ) હાથ.

Sent (સેન્ટ) મોકલ્યું.
(Send નું ભુતકાળ.)
Rent (રેન્ટ) ફાડવું, ભાડું.
Went (ઉર્વેન્ટ) ગયો.
Tent (ટેન્ટ) તંબુ.

LESSON Q. (લેશન ધી સેવટીન્થ.) પાઠ. ૧૭ મો.

Pin (પીન્) અણી.
Hand (હૅન્ડ) હાથ.

q. Ned and I went to the sand(નૅડ્ એન્ડ આઇ ઉવેન્ટ ટુ ધી સેન્ડ) નેડ અને હું રેતી સુધી ગયા.

r. I had to send of my pet dog (આઇ હૅડ્ ટુ સેન્ડ. ઑફ માય પેટ્ ડૉગ્) હું મારા પાળેલા કુતરાંને દૂર મોકલવાનો હતો.

s. Ned sat on the sand, and dug a pit (નૅડ્ સૅટ્ ઑન ધ સેન્ડ્, ઍન્ડ ડગ અ પીટ્) નેડ રેતી ઉપર બેઠો અને ખાડો ખોદયો.

t. I had a big rod in my hand. (આઇ હેડ્ એ બીગ રૉડ્ ઇન માય હેન્ડ્) મારી પાસે હાથમાં મોટા સળી-ઓ છે.

u. The Rod had a bent pin at the end of it. (ધી રૉડ્ હેડ્ એ બેન્ટ પીન્ ઍટ્ ધ એન્ડ્, ઑફ ઇટ્) સળીઆને છેડે અણી વળેલી હતી.

v. Dan sent for his rod; He will lend it to

Bill (ડૅન સેન્ટ ફૅાર હીઝ રૉડ્; હી ઉવીલ હેન્ડ ઇટ્ ટુ બીલ્) ડૅને તેના સળીઆ વાસ્તે મોકલ્યો, તે બીલને તે ઉછીતો આપશે.

w. A big fish will bend his rod (ઍ બીગ ફીશ્ વીલ્ બેન્ડ હીઝ રૉડ્) મોટી માંછલી તેનો સળીઓ વાળી નાંખશે.

x. If we sit on the sand, we will not get a fish (ઇફ્ વી સીટ્ ઑન ધી સૅન્ડ, ઉવી ઉવીલ્ નૉટ ગેટ્ એ ફીશ્) જો આપણે રેતી ઉપર બેસીએ તો આપણે માંછલી મેળવીશું નહીં.

y. We will dig a pit in the sand to sit in (ઉવી ઉવીલ્ ડીગ્ એ પીટ્ ઇન ધ સેન્ડ ટુ સીટ્ ઇન્) અમે અંદર બેસવાને રેતીમાં ખાડો ખોદીશું.

z. I have a big bun in my hand (આઇ હૅવ્ એ બીગ્ બન્ ઇન માય હૅન્ડ) મારી પાસે મારા હાથમાં મોટો રૉટલો છે.

Page 26 (પેઇજ ટ્વેન્ટી સીક્સ્થ) પાનું ૨૬ મું.

LESSON R. (લેશન આર) પાઠ ૧૭ મો.

r. Dan has his tent on the hill (ડૅન્ હૅઝ હીઝ ટેન્ટ ઑન્ ધી હીલ્) ટેકરી ઉપર ડૅનનો તંબુ છે.

s. The pig will rend it if he can (ધ પીગ ઉવીલ્ રેન્ડ ઇટ ઇફ્ હી કૅન્) ડુક્કર જો તેનાથી બની શકશે તો

તે ફાડી શકશે.

t. Nell will mend the rent (નૅડ્ ઉવીલ્ મેન્ડ ધ રેન્ટ) નેડ તે ફાટેલું સાંધશે.

u. Dan will let us sit in his tent (ડૅન ઉવીલ્ લેટ અસ સીટ્ ઇન હીઝ ટેન્ટ) ડૅન તેના તંબુમાં અમને બે-સવા દેશે.

v. We can not sit on the wet sod(ઉવી કૅન નૉટ્ સીટ્ ઑન્ ધ વેટ્ સોડ) અમે ભીની જગા ઉપર બેસી શકીશું નહીં.

w. We can get a rug to sit on (ઉવી કૅન્ ગેટ્ એ રગ્ ટુ સીટ્ ઑન્) અમે બેસવાને કામળો મેળવી શકીશું.

x. Nell will lend us a rug, and send it up to us (નૅલ્ ઉવીલ્ લેન્ડ અસ અ રગ, ઍન્ડ સેન્ડ ઇટ્ અપ્ ટુ અસ્) નૅલ અમને કામળો ઉછીતો આપશે, અને તે અ-મારી પાસે ઉપર મોકલશે.

y. Bill led my kid up to the tent (બીલ્ લેડ્ માય કીડ્ અપ્ ટુ ધ ટૅન્ટ્) બીલ મારા બકરીના બચ્ચાંને તંબુ સુધી ઉપર દોરશે.

z. It can run well up the hill (ઇટ્ કૅન્ રન ઉવેલ અપ્ ધ હીલ્) તે ટેકરી ઉપર સારી પેઠે દોડી શકશે.

a. My pet kid has a bell. (માય પેટ્ કીડ્ હૅઝ એ બેલ્) મારા પાળેલા (બકરીના) બચ્ચાંને ઘંટડી છે.

Page the 28 (પેઇજ ધી ટુવેન્ટીએઇથ) પાનું આટાવીસમું.

Ast (આસ્ટ્) નો મીનીંગ થતો નથી.

Fast (ફાસ્ટ્) ઉતાવળ.

Mast (માસ્ટ્) ડોળ.

Past (પાસ્ટ્) વહી ગયો, જતો રહેતો. પાછલું ભુતકાળ.

Last (લાસ્ટ્) છેલ્લો.

We (ઉવી) અમે.

Est (એસ્ટ) નો અર્થ થતો નથી.

Best (બેસ્ટ) સઉથી સરસ.

Nest (નેસ્ટ) માળો.

Rest (રેસ્ટ) આરામ.

West (ઉવેસ્ટ) પશ્ચિમ.

See (સી) જોવું.

Ust (અસ્ટ) નો ઉચ્ચાર થતો નથી.

Must (મસ્ટ્) જોઇએ.

Dust (ડસ્ટ્) ધૂળ.

Gust (ગસ્ટ્) સપાટો.

Just (જસ્ટ) બરાબર.

To (ટુ) પાસે.

In (ઇન્) અંદર.

Win (ઉવીન) જીતવુ.

Wind (ઉવીન્ડ) પવન.

Ip (ઇપ) નો મીનીંગ થતો નથી.

Ship (શીપ્) વહાણ.

To (ટુ) પાસે.

Too (ટૂ) વળી.

LESSON S. (લેશન નાઇનટીંથ) પાઠ ૧૯ મો.

s. We have run fast up the hill (ઉવી હૅવ રન્ ફાસ્ટ્ અપ્ ધ હીલ્) અમે ટેકરી ઉપર જલદીથી દોડયા છીએ.

t. We can sit and rest on the sod (ઉવી કૅન્ સીટ્ ઍન્ડ રેસ્ટ ઑન ધી સોડ્) અમે જમીન ઉપર બેસી શકશું અને આરામ લેઇશું.

u. If we can run too fast, we must rest (ઈફ ઉવી કૅન રન ટૂ ફાસ્ટ્, ઉવી મસ્ટ્ રેસ્ટ્) જો અમે ઘણા જલદીથી દોડીએ તો અમારે આરામ લેવો જોઇએ.

v. Do not sit in the dust, sit on the sod (ડુ નૅાટ્ સીટ્ ઇન ધી ડસ્ટ્ સીટ્ ઑાન્ ધી સોડ્) ધૂળમાં બેસતા નહીં, જમીન ઉપર બેસો.

w. The Dust on this hill is not wet (ધ ડસ્ટ્ ઑાને ધીસ્ હીલ ઇઝ નૅાટ્ ઉવેટ્) આ ટેકરી ઉપરની ધૂળ ભીંજાયેલી નથી.

x. That is a big gust of wind (ધેટ્ ઇઝ એ બીગ્ ગસ્ટ્ ઑાફ ઉવીન્ડ) તે પવનનો મોટો સપાટો છે.

y. Just see it send up the dust (જસ્ટ્ સી ઇટ્ સેન્ડ અપ્ ધ ડસ્ટ્) જુઓ હમણાં ધૂળ ઉંચે આવી.

z. The sun will set in the west (ધ સન્ ઉવીલ્ સેટ્ ઇન ધી વેસ્ટ્) સૂરજ પશ્ચિમમાં આથમશે.

a. Let us sit till we see it set (લેટ્ અસ સીટ્ ટીલ ઉવી સી ઇટ સેટ્) જ્યાં સુધી તેને આથમતો જોઇએ ત્યાં સુધી આપણે બેસીએ.

b. The sun has set; Let us run fast to the tent (ધ સન્ હૅઝ સેટ્, લેટ અસ રન ફાસ્ટ્ ટુ ધી ટેન્ટ) સૂરજ આથમ્યો છે. ચાલો તંબુ સુધી જલદી દોડીએ.

LESSON T. (લેસન ટી) પાઠ ૨૦ મો.

t. I can see the mast of a ship (આઇ કૅન્ સી ધ માસ્ટ ઑફ્ એ શીપ્) હુ વહાણનો ડોલ જોઇ શકું છું.

u. It is a big ship, Can it go fast? (ઇટ્ ઇઝ એ બીગ્ શીપ્, કૅન ઇટ્ ગો ફાસ્ટ?) તે મોટું વહાણ છે, જલદી જઇ શકશે?

v. It can go fast with the wind (ઇટ્ કૅન્ ગો ફાસ્ટ્ ઉવીથ ધી ઉવીન્ડ) તે પવનથી જલદીથી જઇ શકશે.

w. Will the wind bend the mast? (ઉવીલ ધી ઉવીન્ડ્ બૅન્ડ ધ માસ્ટ્?) પવન ડોળને વાળી શકશે.

x. No, the mast is too big for that (નૉ, ધી માસ્ટ ઇઝ ટુ બીગ્ ફૅાર ધૅટ્) ના, ડોલ તેને વાસ્તે ઘણો મોટો છે.

y. We will see the ship go fast (ઉવી ઉવીલ સી ધ શીપ્ ગો ફાસ્ટ) અમે વહાણ જલદી જતું જોઇશું.

z. Let us go up the hill and see it (લેટ્ અસ ગો અપ્ ધી હીલ્ ઍન્ડ સી ઇટ્) ટેકરી ઉપર જઇએ અને તે જોઇએ.

a. We will see best on the hill (ઉવી ઉવીલ સી બેસ્ટ ઑાન ધી હીલ્) આપણે ટેકરી ઉપર ઘણી સરસ રીતે જોઇશું.

b. The last we see of the ship is the mast (ધી લાસ્ટ્ ઉવી સી ઑફ્ ધ શીપ્ ઇઝ ધ માસ્ટ્) વહાણનું જે છેલું જોઇએ છીએ તે ડોલ છે.

e. Let us go and see if my hen has an egg in the nest (લેટ્ અસ ગો એન્ડ સી ઇફ્ માય હેન્ હેઝ એન્ એગ ઇન ધ નેસ્ટ) ચાલો આપણે જઇએ અને જોઇએ કે મારી મુરઘીની પાસે માળામાં એક ઇંડું છે.

Page 30 (પેઇજ થર્ટી) પાનું ૩૦ મું.

Ing (ઇંગ) નો અર્થ થતો નથી.
Sing (સીંગ) ગાવું.
Ring (રીંગ) વગાડવું.
Ling (લીંગ) એક જાતની માછલી.
Sang (સેન્ગ) ગાવું. (Sing નું ભૂતકાળ)
Rang (રેંગ) વગાડવું. (Ring નું ભુતકાળ)
Hang (હેંગ) લટકાવવું.
Ding (ડીંગ્) વગાડવું.
Ding-Dong (ડીંગ-ડૉંગ) એક જાતનો અવાજ છે.
Song (સોંગ) ગાયન.
Long (લોંગ) લાંબું.
Gong (ગોંગ્) ઘડીયાળ.
Sung (સ્નગ્) ગાવું.
Rung (રંગ્) વડાડવું.
Hung (હંગ) લટકાવ્યું.

LESSON U. (લેશન યુ) પાઠ ૨૧ મો.

u. We must sing a song if we can. (ઉવિ મસ્ટ સીંગ એ સોંગ ઇફ્ ઉવી કેન્) જો આપણાથી બની શકે તો આપણે ગાયન ગાવું જોઇએ.

v. The song will not be a long. (ધી સોંગ વીલ નોટ્ બી એ લોન્ગ) ગાયન લાંબુ હશે નહિ.

w. If we sing long, we do not sing well (ઇફ

હવી સીંગ લૉંગ, ઠિઝ નૉટ્ સીંગ હવેલ) જો આપણે લાંબુ ગાઇએ તો આપણે સારૂં ગાતા નથી.

x. A long song is not well sung (એ લૉંગ સૉંગ ઇઝ નૉટ્ ઉવેલ સંગ) લાંબુ ગીત સારી રીતે ગવાતું નથી.

y. Dan went off to fish with a rod (ડૅન વેન્ટ ઑફ્ ટુ ફીસ વીથ એ રૉડ) ડેન સળીઓ લેઇને માંછલી પકડવાને દૂર ગયો.

z. He sang a song as he went (હી સેંગ એ સૉંગ એઝ હી વેન્ટ) જેવો તે ગયો તેવોજ તેણે ગીત ગાયું.

a. He got a big fish on his rod, It is a big ling (હી ગોટ એ બીગ ફીસ ઑન હીઝ રૉડ્, ઇટ ઇઝ એ બીગ્ લીંગ) તેણે તેના સળીઆ ઉપર એક મોટી માંછલી મેળવી. તે એક જાતની મોટી માંછલી છે.

b. He has hung it up in the hut (હી હેઝ હંગ ઇટ અપ ઇન ધ હટ્) તેણે તેને ઝુંપડામાં ઉંચે લટકાવી છે.

c. Do not let it hang long (ડુ નૉટ્ લેટ્ ઇટ્ હેંગ લોંગ) તેને લાંબા વખત સુધી લટકાવી રાખતા નહીં.

d. The hut must be shut so that the cat will not get in (ધ હટ્ મસ્ટ્ બી સ્હટ્ સો ધૅટ્ ધ કૅટ્ ઉવીલ નોટ્ ગેટ્ ઇન) ઝુંપડુ બંધ કરવું જોઇએ. એટલા માટે કે બીલાડી અંદર પેસે નહિ.

Page 81 (પેઇજ ઍટીન) પાનું ૮૧ મું.

LESSON V. (લેશન વી) પાઠ ૨૨ મો.

v. My dog must be fed, for the sun is in the west (માય ડૉગ મસ્ટ બી ફેડ્, ફૉર્ ધી સન્ ઇઝ ઇન ધી વેસ્ટ) મારા કુતરાને ખવરાવવું જોઇએ. કારણ કે સુરજ પશ્ચીમમાં છે.

w. Ben, will lend me, his tin dish (બેન ઉવીલ્ લેન્ડ મી, હીઝ ટીન ડીસ્) બેન તેની કથાઇની રકાબી મને ઉછીની આપશે.

x. My kid has to be fed too (માય કીડ હૅઝ ટુ બી ફેડ ટુ) મારા બકરીના બચ્ચાને ઘણું ખવરાવવાનું છે.

y. The sun has set, we must go in (ધી સન હૅઝ સેટ્, વી મસ્ટ ગો ઇન્) સુરજ અસ્ત પામ્યો છે. આપણે અંદર જવું જોઇએ.

z. Nell rang the big bell, Ding-dong, ding-Dong (નેલ્ રેંગ ધ બીગ, બેલ્ ડીંગ ડોંગ, ડીંગ ડોંગ) તેણે મોટો ઘંટ વગાડયો, ડીંગ ડોંગ, ડીંગ ડોંગ.

a. Is it a gong? no, it is a bell (ઇઝ ઇટ્ એ ગોંગ ? નૉ, ઇટ ઇઝ એ બેલ) તે ઘડીયાળ છે ? ના, તે ઘંટ છે.

b. A gong will not ring so well (એ ગોંગ વીલ નોટ્ રીંગ સો વેલ્) ઘડીયાળ એવી સારી રીતે વાગશે નહિ.

c. A gong has to be hit with a rod (એ ગોંગ

હેઝ ટુ બી હીટ્ ઉવીથ એ રૉડ) ઘડીયાળ સળીઆથી વગાડવાનું છે.

d. We must run in fast (ઉવી મસ્ટ રન્ ઇન ફાસ્ટ્) આપણે જલદીથી દોડવું જોઇએ.

e. I am not to be the last (આઇ ઍમ્ નોટ્ ટુ બી ધ લાસ્ટ) હું છેલ્લો થવાનો નથી.

Page 33 (પેઇજ થર્ટીથ્રી) પાનું ૩૩ મું.

Ack (ઍક) નો મીનીંગ થતો નથી.
Back (બૅક) પીઠ, પાછું.
Pack (પૅક) ગાંસડી બાંધવી.
Sack (સૅક) કોથળો.
Eck (એક) નો મીનીંગ થતો નથી.
Deck (ડેક) તુતક.
Neck (નેક) ગરદન.
Peck (પેક) ચાંચ મારવી.
Jack (જેક) નામ છે.
Dick (ડીક) નામ છે.
Ick (છક) નો મીનીંગ થતો નથી.
Kick (કીક) લાત મારવી.
Sick (સીક) માંદું.
Pick (પીક) ઉચકી લેવું.
Ock (ઑક) નો મીનીંગ થતો નથી.
Rock (રૉક) ખડક.
Mock (મૅાક) મશ્કરી કરવી.
Lock (લૉક) તાળુ.

LESSON W (લેસન ડબલ્યુ) પાઠ ૨૩ મો.

w. We must lock up the shed (ઉવી મસ્ટ્ લૉક અપ ધી સેડ્) આપણે ઝુંપડાંને તાળુ વાસવું જોઈએ.

x. We are to go back to the sand (ઉવી આર

ડુ ગો બેક ડુ ધ સેન્ડ) આપણે રેતી સુધી પાછું જવાનું છે.

y. Pick up that box; I wish it (પીક્ અપ્ ધેટ્ બૉક્સ, આઇ વીસ્ ઇટ્) તે પેટી ઉચકો, હું તેને ચાહું છું.

z. Dig a pit for it in the sand (ડીગ એ પીટ્ ફૉર ઇટ્ ઇન ધી સેન્ડ) રેતીમાં તેને વાસ્તે ખાડો ખોદો.

a. We can pack a peck of sand in-to a box (ઉવી કેન્ પૅક એ પેક ઑફ સેન્ડ ઇન્ટુ એ બોક્ષ) અમે પેટીમાં રેતીનીગાંસડી મજબુત ભરી શકીશું.

b. Dick has a big sack of sand (ડીક હેઝ એ બીગ સેક ઑફ સેન્ડ) ડીક પાસે રેતીનો મોટો કોથળો છે.

c. He has set it up on a rock (હી હેઝ સેટ્ ઇટ્ અપ્ ઑાન એ રૉક) તેણે ખડકપર ઉંચે તે મુકયું છે.

d. The sack is too big for Dick (ધી સેક્ ઇઝ ટુ બીગ ફૉર ડીક) કોથળો ડીકને વાસ્તે ઘણો મોટો છે.

e. Do not mock at him, or kick him, for he is sick (ડુ નૉટ્ મોક એટ્ હીમ્, ઑાર કીક હીમ્, ફૉર હી ઇઝ સીક) તેની મશ્કરી કરતા નહીં અથવા લાત મારતા નહીં. કારણ કે તે માંદો છે.

f. He hit his neck on a rock, but he will get well (હી હીટ્ હીઝ નેક ઑાન એ રૉક, બટ હી ઉવીલ ગેટ્ એ ઉવેલ) તેણે ખડકપર તેની ગરદન મારી, પણ તે

સારો થશે..

Page 34 (પેઇજ થર્ટી ફોર) પાનું ૩૪ મું.

LESSON X (લેશનએક્ષ) પાઠ. ૨૪ મો.

x. Jack is on the deck of the ship (જેક ઇઝ ઑન ધી ડેક ઑાફ ધી શીપૂ) જેક વહાણના તુટક ઉપર છે.

y. The ship has just got back (ધી શીપ હેઝ જસ્ટ ગોટ્ બેક) વહાણ તરતજ પાછાં આવ્યું છે.

z. Jack has a big rod to fish with (જેક હેઝ એ બીગૂ રૉડ્ ટુ ફીસ ઉવીથ) જેક પાસે માછલી પકડવાને મોટો સળીઓ છે.

a. The fish is got up on the deck by a rod. (ધી ફીશ ઇઝ ગોટ્ અપૂ ઑાન ધી ડેક બાય એ રોડ્) માંછલીને સળીઆથી તુટક ઉપર ઉંચી કરી છે.

b. He has got a big cod, and a ling (હી હેઝ ગોટ્ એ બીગ કોડ્ એન્ડ એ લીંગ) તેણે એક મોટો કૉડ માંછલી અને લીંગ માંછલી મેળવી છે.

c. Let us get a tub for a fish (લેટ્ અસ ગેટ્ એ ટબ્ ફૉર એ ફીષ્) અમને માંછલી વાસ્તે પીપ મેળવવા દો.

d. He has cut off a tin for the cat (હી હૅઝ કટ્ ઑાફ એ ટીન ફૉર ધં કૅટ્) તેણે બીલાડીને વાસ્તે માંછલીની પાંખ કાપી છે

e. The cat will get the fin (ધી કૅટ્ ઉવીલ ગેટ્ ધી ફીન્) બીલાડીએ માંછલીની પાંખ મેળવી છે.

f. I wish I had to go on a ship (આઈ વીસ આઈ હૅડ્ ટુ ગો ઑન એ શીપ્) હું ઇચ્છું છું કે મારે વહાણ ઉપર જવાનું હતું.

g. A ship can go fast, but not so fast as a fish (એ શીપ્ કૅન્ ગો ફાસ્ટ્, બટ્ નોટ્ સો ફાસ્ટ ઍઝ એ ફીસ) વહાણ જલદીથી જઈ શકશે. પણ માંછલી પેઠે એટલી બધી ઉતાવળથી જશે નહીં.

Page 35 (પેઇજ થર્ટી ફીફ્થ) પાનું પાંત્રીસમું.

Words exercises (વર્ડઝ એક્સરસાઇઝ) શબ્દના પાઠો.

Em (એમ્) ના મીનીંગ થતો નથી.
Hem (હેમ) પાલવ.
Them (ધેમ્) તેમને.
Stem (સ્ટેમ) થડ.
Bless (બ્લેસ) સુખ.
Cress (ક્રેસ) આકાશ દીવો.
Dress(ડ્રેસ) લુંગડા.
Gress (ગ્રેસ) કલ્પના.
Less (લેસ્) ઓછું.
Mess(મેસ)ભેળસેળ કરીદેવું.

Press (પ્રેસ) દબાણ.
Tress (ટ્રેસ) વાળનો ગુચ્છો.
Stress (સ્ટ્રેસ) ભાર.
Left (લેફ્ટ) છોડયું.
Cleft (ક્લેફ્ટ્) ફાટ પડી.
Reft (રેફ્ટ) લૂંટી લીધું.
Weft (વેફ્ટ્) વાણ.
Theft (થેફ્ટ) ચોરી.
Belt, (બેલ્ટ્) પટો.
Felt (ફેલ્ટ) લાગ્યું.
Melt (મેલ્ટ્) પીગાળવું.

Pelt (પેલ્ટ) પથરા મારવા.
Edge (એજ) કીનાર—કોર.
Hedge (હેજ્) વાડ.
Ledge (લેજ્) કોર.
Sedge (સેજ) ડાભ.
Wedge (વેજ) ફાચર.
Cliff (ક્લીફ) ટેકરી.
Stiff (સ્ટીફ) અકકડ.
Whiff (વ્હીફ) દમ.
Gift (ગીફ્ટ) બક્ષીસ.
Lift (લીફ્ટ) ઊંચકવું.
Sift (સીફ્ટ) ચાળવું.
Rift (રીફ્ટ) ફાટ, તરડ.
Drift (ડ્રીફ્ટ) ઘસડાયેલું.
Ilk (ઇલ્ક) નો મીનીંગ થતો નથી.
Milk (મીલ્ક) દુધ.
Silk (સીલ્ક્) રેશમ.
Iss (ઈસ) નો મીનીંગ થતો નથી.
Hiss (હીસ્) હિસ કરીને કરીને બોલવું તે. તિરસ્કાર કરવો, ફૂંફાડો મારવો.
Kiss (કીસ) બચ્ચી.
Miss (મીસ્) ખોવું, ભુલવું.
Bliss (બ્લીસ) સુખ.
Ist (ઇસ્ટ્) નો મીનીંગ થતો નથી.
Fist (ફીસ્ટ) મુક્કી.
List (લીસ્ટ્) ટીપ.
Mist (મીસ્ટ્) દવ, ઝાકળ.
Grist (ગ્રીસ્ટ્) ઓરણું, બાંગરાકી.
Whist (વીસ્ટ) ચુપ.
Wist (ઉવીસ્ટ્) છાનો રહે,
Twist (ટવીસ્ટ્) નીચોવવું, આમળવવું.
Ir (અર) નો મીનીંગ થતો નથી.
Fir (ફર્) દેવદાર.
Sir (સર્) મહેરબાન સાહેબ.
Stir (સ્ટર્] હલાવવું.
Ix (ઇક્ષ) નો મીનીંગ થતો નથી.
Fix (ફીક્ષ) ગોઠવવું.
Mix (મીક્ષ) મીશ્રણ કરવું. મેળવવું.

Ird (અર્ડ) નો મીનીંગ થ-
તો નથી.
Bird (બર્ડ) પક્ષી.
Third (થર્ડ) ત્રીજું.
Irst (અર્સ્ટ) નો મીનીંગ
થતો નથી.
First (ફર્સ્ટ) પહેલું.
Thirst (થર્સ્ટ) તરસ.
Oss (ઑસ) નો મીનીંગ
થતો નથી.
Loss (લૅાસ) ખોટ.
Moss (મૅાસ) લીલ.
Toss (ટૅાસ) ફૂંકવું.
Orn (ઑર્ન)નો મીનીંગ થતો નથી.
Born (બૅાર્ન) જન્મેલું.
Corn (કૅાર્ન) અનાજ.
Horn (હૅાર્ન) શીંગડું.
Morn (મૅાર્ન) સવાર.
Torn (ટૅાર્ન) ફાડેલું.
Thorn (થૅાર્ન) કાંટો.

The Royal Crown Primer No. II.

Page 6 (પેઇજ઼ ધી સીક્સ્થ) પાનું છઠું.

Ake (એઇક) નો મીનીંગ થ-
તો નથી.
Bake (બેઇક) શેકવું.
Cake (કેઇક) રોટલી, ભા-
ખરી.
Take (ટેઇક) લેવું.
Lake (લેઇક) તળાવ.
Make (મેઇક) કરવું.
Ade (એઇડ઼) નો મીનીંગ
થતો નથી.
Made (મેઇડ઼) બનાવ્યું.
Wade (ઉવેઇડ઼) પાણીમાં
ખુંદવું; ચાલવું.
Ar (આર) નો મીનીંગ થ-
તો નથી.
Car (કાર઼) ગાડી.
Far (ફાર઼) દૂર.
Then (ધેન઼) પછી.
When (વ્હેન઼) જ્યારે.

LESSON 1. (લેશન ધી ફર્સ્ટ) પાઠ ૧ લો.

Hill (હીલ્) ટેકરી.
Best (બેસ્ટ્) સઉથી સરસ.
Sit (સીટ્) બેસવું.
Dan (ડૅન્) માણુસનું નામ છે (ડૅન્)
Make us sit આપણુને બેસાડશે.
Get to lake (ગેટ્ ટુ લેઇક) તળાવ સુધી પોંહચવું.

To far off (ટુ ફાર ઑફ્) ઘણેજ દુર.
Rock (રૉક) ખડક.
Nell (નેલ્) માણુસનું નામ છે. (નેલ્)
Set (સેટ્) ગોઠવવું, મુકવું.
Will let us have a run આપણુને દોડ લેવા દેશે.

1. Are we to go up to the hill? No, we are not; we are to go to the lake (આર્ ઉવી ટુ ગો અપ્ ટુ ધી હિલ્? નો, ઉવી આર નોટ્; ઉવી આર ટુ ગો ટુ ધી લેઇક્) અમે ટેકરી સુધી ઉપર જવાના છીએ? ના, અમે જુવાના નથી. અમે તળાવ સુધી જવાના છીએ.

2. Nell is to bake us a cake, We can take it with us (નૅલ્ ઇઝ ટુ બેઇક અસ્ એ કેઇક્, ઉવી કૅન્ ટેઇક ઇટ્ ઉવીથ અસ્) નેલ રોટલી શેકવાનો છે. અમે અમારી સાથે તેને લેઇ શકીશું.

3. Is not the lake too far off? Not if we can get a car to take us (ઇઝ નૉટ્ ધી લેઇક્ ટુ ફાર ઑફ્? નૉટ્ ઇફ્ ઉવી કૅન્ ગેટ્ એ કાર્ ટુ ટેઇક અસ્) ત-

ળાવ ઘણેજ દુર નથી ? અમે એમને લેવાને ગાડી લેઇ શ-
કાશું નહી.

4. Dan will get a car, to take us to the lake. That will be best (ડૅન્ ઉવીલ ગેટ્ એ કાર્, ટુ ટેહ્ક અસ ટુ ધી લેઇક્. ધૅટ્ ઉવીલ બી બેસ્ટ) ડૅન તળાવ સુધી આપણને લેવાને ગાડી મેળવશે. તે સઉથી સરસ છે.

5. Then we can run on the sand, or wade in the lake; or sit on a rock (ધૅન્ ઉવી કેન્ રન્ ઑન્ ધી સેન્ડ્, ઑર ઉવેઇડ્ ઇન ધ લેઇક્ ઑર્ સીટ્ ઑન્ એ રૉક) ત્યારે અમે રેતી ઉપર દોડી શકીશું અથવા તળા-બમાં ચાલી શકીશું. અથવા ખડક પર બેશી શકીશું.

6. Let us get a box for cake that Nell has made, Set it in the Car (લેટ્ અસ્ ગેટ્ એ બૉક્ષ ફૉર કેઇક્ ધૅટ્ નેલ્ હેઝ મેઇડ્, સેટ્ ઇટ ઇન ધ કાર્) નેલે જે પેટી બનાવી છે, તે અમને રોટલી વાસ્તે મેળવવા દો, તેને ગાડીમાં મુકો.

7. I see Dan with his car; he will make us sit in it (આઇ સી ડૅન ઉવીથ હીઝ કાર્, હી ઉવીલ મે-ઇક અસ સીટ્ ઇનઇટ્) હું ડૅન ને તેની ગાડી પાસે જોઉ છું. તે અમને તેની અંદર બેસાડશે.

8. He will let us have a run, when we get to the lake. (હી ઉવીલ લેટ્ અસ હૅવ એ રન્, વ્હેન ઉવી ગેટ્ ટુ ધ લેઇક્) જ્યારે અમે તળાવ સુધી જઇએ

ત્યારે તે અમોને દોડવા દેશે.

9. We must sit in the car, for it is too far for us to run. (ઉવી મસ્ટ્ સીટ્ ઇન્ ધી કાર્, ફૉર્ ઇટ ઇઝ ટુ ફાર ફૉર્ અસ ટુ રન્) અમારે ગાડીમાં બેસવું જોઇએ. કારણકે તે દોડવાનું અમારે વાસ્તે ઘણુંજ દૂર છે.

10. We can take my pug dog whith us. I wish we had a big dog too, (ઉવી કૅન્ ટેઇક માય પગ્ ડૉગ્ ઉવીથ અસ, આઇ ઉવીસ ઉવી હેડ્ એ બીગ્ ડૉગ ટુ) અમે અમારી સાથે મારો વાંદરાનાં જેવા નાક વાળા કુતરાને લેઇ શકીશું. હું ઇચ્છુછું. અમારી પાસે વળી મોટો કુતરો હતો.

Page (પેઇજ્ એઇટથ) પાનું આઠમું.

Ass (આસ, ઍસ્)ગધેડો.
Pass (પાસ) રસ્તો, પાસે થઇને જવું.
Grass (ગ્રાસ્) ઘાસ.
Ide (આઇડ્) નો મીનીંગ થતો નથી.
Ride (રાઇડ્) સ્વારી કરવી. ઘોડે બેસવું

Side (સાઇડ્) બાજુ.
Ice (આઇસ) બરફ.
Nice (નાઇસ્) સુંદર.
Slice (સ્લાઇસ્) કડકો.
Eat (ઇટ્) ખાવું.
Seat (સીટ્) બેઠક.
Treat (ટ્રીટ્) વર્તવું.

Lesson 2 (લેશન ધી સેકન્ડ) પાઠ ૨ જો.

By the side of the lake તળાવની બાજુ પાસે.
Bun (બન્)રોટલી.
Wish (ઉવીસ) ઇચ્છવું.

Hut (હટ્) ઝુંપડું.
To let us have a ride અમને સ્વારી કરવા દેવાને.
Fast (ફાસ્ટ્) જલદીથી.

Page 10 (પેઇજ્ ટેન્) પાંનુ દશમું.

Oat (ઓટ્) એક જાતનું અનાજ છે.
Boat (બોટ્) મછવો.
Coat (કોટ્) ડગલો.
Float (ફ્લોટ્) તળવું.
Ore (ઓર્) કાચી ધાતું.
More (મોર્) વધારે.
Tore (ટોર્) ફાડયું.

Shore (શોઅર્) કિનારો.
Ow (ઓ) નો અર્થ થતો નથી.
Row (રો) હાર, હલેશાં મારવાં.
Blow (બ્લો) ઘા.
Show (શો) તમાસો, બતાવવું.
For (ફોર્) માટે, વાસ્તે, કેમકે.
From (ફ્રૉમ્) માંથી.
Saw (શૉ) જોયું, કરવત.

Lesson 3 (લેશન થર્ડ) પાઠ ૩ જો.

That (ધેટ્) જે.
Hot (હૉટ) ગરમ. તપેલો.
Sun (સન્) સૂરજ.
Made to Awake off કાઢી નાંખવો પડયો.
Made the boat go હોડી ચલાવી.

Let eat grass ઘાસ ચરવાદો.
He had his coat off તેણે પોતાનો ડગલો કાઢી નાંખ્યો હતો.
Deck (ડેક) તૂટક.
Rent રેન્ટ) ફાટ, ચીરાડો.
Mend (મેન્ડ્) સુધારવું.
Grass (ગ્રાસ) ઘાસ.

Page 12 (પેઇજ્ ટ્વેલ્થ) પાનું ૧૨ મું,

Ay (એ)નો મીનીંગ થતો નથી,
Bay (બે) અખાત.
Day (ડે) દહાડો.

Ook (ઉક)નો મીનીંગ થતો નથી.
Book (બૂક) ચોપડી.
Took (ટૂક) લીધું.

Hay (હે) સુકું ઘાસ.
Play (પ્લે) રમવું.
Stay (સ્ટે) થોભવું.
Look (લુક)જોવું, નજર.
Nook (નૂક) ખુણો.
Shook (શૂક)હલાવ્યું.

Lesson 4 (લેશન ફૉર્થ) પાઠ ૪ થો.

Float (ફ્લૉટ્)તળવું, તળાપો.
To se make (ટુ સી મેઇક) બનાવતો જોવાને.
Rest (રેસ્ટ) આરામ.
Got Back(ગોટ બેક)પાછો ફર્યો.

Page (પેઇજ થર્ટીન્થ) પાનું ૧૩ મું.

Ade (એઇડ્)નો મીનીંગ થતો નથી.
Fade (ફેઇડ્) કરમાઇ જવું.
Shade(શેઇડ્) છાંયો
Blade (બ્લેઇડ્)પાનું (ચપ્પનું) તણુખલું.
Ail (એઇલ) દુઃખ થાયછે.
Sail (સેઇલ) હંકારવું.
Nail (નેઇલ) ખીલો.
Fail (ફેઇલ) નીષ્ફળ થવું.
All (ઑલ) સઘળા.
Ball(બૉલ) દડો
Fall (ફૉલ્) પડવું.
Call (કૉલ) બોલાવવું.

Lesson 5 (લેશન ફીફ્થ) પાઠ પાંચમો.

To have (ટુહેવ્) લેવાને.
Boat (બોટ્) મછવો.
Hot (હોટ્) ગરમ.
Cut grass (કટ્ ગ્રાસ) કાપેલું ઘાસ.
Got up (ગોટ્ અપ્) ઉઠ્યો.
Ball (બૉલ્) દડો.

Page 16 (પેઇજ્ સીક્સ્ટીન્થ) પાનું ૧૬ મું.

Words excrcises (વર્ડ્ઝ એક્સરસાઇઝીઝ.) શબ્દના અભ્યાસ પાઠ.

શબ્દના પાઠ.

Age (એઇજ) ઉંમર.
Cage (કેઇજ) પાંજરૂં.
Page (પેઇજ) પાનું, ચાકર.
Rage (રેઇજ) ગુસ્સો: સરત બકવી.
Wage (ઉવેઇજ) (લડાઇ) ચલાવવી,
Sage (સેઇજ) ડાહ્યો પુરૂષ.
Stage (સ્ટેઇજ) નાટક સ્થળ, ઊંચુ સ્થાન.
Ale (એઇલ)એક જાતનો દારૂ.
Bale (બેઇલ) ગાંસડી.
Dale (ડેઇલ) ખીણ.
Gale (ગેઇલ) પવનની લેહેર.
Male (મેઇલ) નર.
Sale (શેઇલ) વેચાણ.
Tale (ટેઇલ) વાત.
Stale (સ્ટેઇલ) વાસી.
Whale (ઉન્હેઇલ) મગરમચ્છ.
Ape (એઇપ) વાંદરાની જાતછે.
Cape (કેઇપ) ભુશીર.
Gape (ગેઇપ) બગાસુ.
Tape (ટેઇપ) પટી.
Grape (ગ્રેઇપ) દ્રાક્ષ.
Ane (એઇન)મીનીંગ થતો નથી
Bane (બેઇન) વિખ, ખરાબી.
Cane (કેઇન) નેતર.
Lane (લેઇન) ગલી.
Pane (પેઇન) કાચનો તકતો.
Sane (સેઇન) સાજો.
Wane (ઉવેઇન) ઓછું થવું, (ચંદ્રનું કળામાં).
Plane (પ્લેઇન) રંદો.
Aste (એઇસ્ટ)મીનીંગ થતો નથી
Haste (હેઇસ્ટ) ઉતાવળ.
Paste (પેઇસ્ટ). લાહી.
Taste (ટેઇસ્ટ), સ્વાદ, ચાખવું.
Waste (ઉવેઇસ્ટ) ગુમાવવું.
Aid (એઇડ) મદદ.

Laid (લેઇડ) મૂકયું.
Maid (મેઇડ) કુમારીકા, કન્યા.
Paid (પેઇડ) પૈસા આપ્યા.
Raid (રેઇડ) હુમલો કરવો.
Staid (સ્ટેઇડ) શાણો, ગંભીર.
Braid (બ્રેઇડ) અંબોડો.
Air (એર) હવા.
Fair (ફેર) સુંદર, મેળો.
Hair (હેર) વાળ.
Lair (લેર) વાઘ વરૂને સંતાઇ
રહેવાની જગ્યા, ગુફા.
Pair (પેર) જોડી.
Stair (સ્ટેર) દાદર, નિશરણી.
Ait (એઇટ)મીનીંગ થતો નથી.
Bait (બેઇટ) ગલ, લાલચ.
Wait (ઉવેઇટ) રાહ જોવી.
Eed (ઇડ) મીનીંગ થતો નથી.
Deed (ડીડ) કામ.
Feed (ફીડ) ખવરાવવું.
Heed (હીડ) ધ્યાન આપવું.
Need (નીડ) જરૂર.
Reed (રીડ) બરૂ.
Seed (સીડ) બી. નીંદવું.
Weed (ઊવીડ) નકામો રોપો,
Steed (સ્ટીડ) ઝડપી ઘોડો.
Greed (ગ્રીડ) લોભ, અકરાંતી.
Creed (ક્રીડ) જાત. આપણું.
Eef (ઇફ) નો મીનીંગ થતો નથી.
Beef (બીફ) માંસ.
Reef (રીફ) ખડક.
Eem (ઇમ)મીનીંગ થતો નથી.
Deem (ડીમ) ધારવું, ગણવું.
Seem (સીમ)દેખાવવું, લાગવું.
Teem (ટીમ) વીઆવું, જન્મ
આપવો.
Eer (ઇર) નો અર્થ થતો નથી
Beer (બીર) દારૂ (એક જાતનો).
Deer (ડીઅર) હરણ.
Peer (પીર) અમીર. જોડીઓ.
Seer (સીર) સેર.
Cheer (ચીઅર)ખુશાલીનો પોકાર
Eet (ઇટ) મીનીંગ થતો નથી.
Beet (બીટ) એક જાતનાં મૂળ.
Feet (ફીટ) પગ.
Meet (મીટ) મળવું.
Sleet (સ્લીટ) કાદવ.

Street (સ્ટ્રીટ) મોહોલ્લો.
Ee-e (ઈ) નો અર્થ થતો નથી.
Fleece (ફ્લીસ), કાતરેલું ઊન.
Geese (ગીઝ) હંસો.
Breeze (બ્રીઝ) પવનની લેહેર.
Freeze (ફ્રીઝ) ઠરાવવું.
Cheeze (ચીઝ) પનીર.
End (ઇડ) નો અર્થ થતો નથી.
Bead (બીડ) કીડીઉ, મણકો.
Lead (લીડ) દોરવું.
Read (રીડ) વાંચવું.
Plead (પ્લીડ) કાલાવાલા કરવા.
Eaf (ઇફ) નો અર્થ થતો નથી.
Leaf (લીફ) પાંદડું.
Sheaf (સીફ) પુળી.
Eath (ઇથ) નો અર્થ થતો નથી.
Heath (હીથ) લીલોત્રી.
Sheath (શીથ) મ્યાન.
Wreath (રીથ) હાર.
Eak (ઇક) નો અર્થ થતો નથી.
Beak (બીક) ચાંચ.
Leak (લીક) કાણું.
Peak (પીક) ટોચ.
Weak (ઉવીક) નબળું. અવાજ થવો.
Creak (ક્રીક) ચરર કરીને
Eal (ઇલ) નો અર્થ થતો નથી
Deal (ડીલ) ઘણું.
Meal (મીલ) ખાણું.
Heal (હીલ) સારૂં કરવું. મટાડવું.
Peal (પીલ) કડાકો.
Seal (સીલ) એક જાતની માછલી.
Steal (સ્ટીલ) ચોરવું.
Eam (ઇમ) નો અર્થ થતો નથી.
Beam (બીમ) બારોટીઓ, કીરણ.
Seam (સીમ) સેવવું.
Team (ટીમ) જુથ, ટોળું.
Cream (ક્રીમ) મલાઇ.
Dream (ડ્રીમ) સ્વપ્નું આવવું.
Steam (સ્ટીમ) વરાળ.
Stream (સ્ટ્રીમ) ઝરો.
Ean (ઇન) નો અર્થ થતો નથી.
Bean (બીન) વાલોડ-વટાણાની શીંગ.
Dean (ડીન) કોલેજનો અધિકારી.
Lean (લીન) આઢેલાને ઉભા રહેવું.
Mean (મીન) અર્થ હોવો, મતલબ હોવી.

Clean (ક્લીન) સાફ.
Eap (ઈપ)—
Heap (હીપ) ઢગલો.
Leap (લીપ) ફલંગ મારવી.
Reap (રીપ) લણવું.
East (ઇસ્ટ) પૂર્વ.
Beast (બીસ્ટ) પશુ, પ્રાણી.
Feast (ફીસ્ટ) ઉજાણી.
Least (લીસ્ટ) સૌથી ઓછું.
Yeast (ઇસ્ટ) ખમીર, તાડી.
Eave (ઇવ) છજુ.
Leave (લીવ) છોડવું, રજા.
Weave (ઉવીવ) વણવું.
Cleave (કલીવ) ચીરવું.
Ease (ઇઝ) સહેલ, આરામ.
Tease (ટીઝ) ખીજવવું.
Please (પ્લીઝ) મહેરબાની ક-
રવી, ખુશ કરવું.

Cease (સીઝ) બંધ કરવું.
Lease (લીઝ) ભાડાચીઠ્ઠી.
Grease (ગ્રીઝ) ચરબી.
Eace (ઇસ) નો અર્થ થતો નથી.
Peace (પીસ) સલાહ.
Ief (ઇફ) નો અર્થ થતો નથી.
Brief (બ્રીફ) ટુંકી.
Chief (ચીફ) મુખ્ય.
Grief (ગ્રીફ) શોક, દીલગીરી.
Thief (થીફ) ચોર.
Ieve (ઇવ) નો અર્થ થતો નથી.
Grieve (ગ્રીવ) દીલગીર થવું.
Thieve (થીવ) ચોરી કરવી.
Iece (ઇસ) નો અર્થ થતો નથી.
Niece (નીસ) ભત્રિજી.
Piece (પીસ) કડકો.

Page 18 (પેઇજ એઈટીન્થ) પાનુ ૧૮ મું.

Be (બી) થવું.
Bee (બી) મધમાખ.
Tree (ટ્રી) ઝાડ.
Free (ફ્રી) સ્વતંત્ર.

Sky (સ્કાય) આકાશ.
Why (વ્હાય) શા વાસ્તે.
Ood (ઉડ) નો ગુજરાતી થતો નથી.
Food (ફુડ) ખોરાક.

By (બાય) પાસેથી.
Fly (ફ્લાય) ઉડવું.
One (વન) એક.
Good (ગુડ) સારૂ.
Wood (વુડ) લાકડું, જંગલ.
Done (ડન્) કર્યું.

Lesson 6 (લેશન ધી શીક્સ્થ.

Nice (નાઇસ) સુંદર.
The food that (ધ ફુડ ધૅટ) જે ખોરાક.
To look for (ટુ લુક ફૉર્) શોધવાને.
Nook (નુક) ખુણો.
All the day (ઑલ ધી ડે) આખો દિવસ.
Shade (શેઇડ) છાયા.
Bee (બી) મધમાંખ.
That is why(ધૅટ ઇઝ વ્હાય) તેટલાજ સારૂ.

Page 20 (ટુવેન્ટીએથ) પાનું ૨૦ મું.

Ame (એઇમ્)નો મીનીંગ થતો.
Came (કેઇમ્) આવ્યો.
Game (ગેઇમ્) શીકાર.
Same (સેઇમ) તેજ.
Name (નેઇમ) નામ.
Lame (લેઇમ્) લંગડો.
Blame (બ્લેઇમ્) ઠપકોદેવો.
Shame (શેઇમ્) સરમ
Ine (આઇન્)નોમીનીંગથતોનથી.
Fine (ફાઇન્) શુંદર.
Pine (પાઇન્) અનાસનુંઝાડ.
Mine (માઇન્) મારૂ.

Lesson the 7 (લેશન ધી સેવન્થ) પાઠ સાતમો,

On the same day તેજદીવસે.
Lad (લેડ્) છોકરો.
Pat (પૅટ) છોકરાનું નામ છે.
Ball (બૉલ) દડો.
Treat (ટ્રીટ) મઝા.
Long (લૉંગ) લાંબો વખત.
To play at રમવાનો.
Was done (વોઝ ડન્)પુરી થઇ.

Can hit (કેન્ હીટ) ફટકો મારી શકે છે.
That is no shame to me એમાં મને કાંઈ શરમ નથી.
Made from the wood of pine અત્રાસના લાકડાની બનાવેલી.

Page 22 (પેઇજ (ટુવેન્થી સેકન્ડ) પાનુ બાવીસ.

Ie (આઇ)નો મીનીંગ થતો નથી.
Lie (લાઇ) પડી રહેવું, જુઠું બોલવું.
Pie (પાઇ) પૈ, ભજીઉં.
Tie (ટાઇ) બાંધવું, ગાંઠ.
Ite (આઇટ) મીનીંગ થતો નથી.
Bite (બાઇટ) કરડવું.
Kite (કાઇટ) પતંગ.
White (વ્હાઇટ) ધોળું.
Ine (આઇન્)નો મીનીંગ થતો નથી.
Dine (ડાઇન્) જમવું.
Line (લાઇન્) લીટી, દોરી.
Twine (ટવાઇન્) સૂતળી.

Lesson 8 (લેશન ધી એઇટથ) પાઠ આઠમો.

Same at ball દડાની રમત.
Dish (ડીસ) રકાબી.
Good (ગુડ) સારૂ.
Took (ટુક) લીધું.
Bite (બાઇટ) બચકુ
Slice (સ્લાઇસ) કડકો.
Wind (ઉવાન્ડ) પવન.
Whitt (વ્હાઇટ) ધોળું.

Page 24 (પેઇજ ટુવેન્ટીફોર્થ) પાનું ચોવીસમું,

Ark (આર્ક) પેટી (એક જાતની)
Hark (હાર્ક) સાંભળો.
Dark (ડાર્ક) અંધારૂં.
Ear (ઇઅર્) કાન.
Hear (હીઅર્) સાંભળવું.
Near (નીયર્) પાસે.

Lark (લાર્ક) ચંડોળ પક્ષી.
Mark (માર્ક) નીશાની.
Park (પાર્ક) બાગ.
Spy (સ્પાય) જોવું.
Shy (શાય) શરમાળ.
Dry (ડ્રાય) સુકું.

Lesson the 9 (લેશન ધ નાઇન્થ) પાઠ નવમો.

Sky-lark (સ્કાઇ લાર્ક) આંકાશમાંનું ચંડોળ પક્ષી.
No more (નો મૉર્) કાંઇ વધારે વાર નહીં.
It can fly--fall એવી સારી રીતે ઉડી શકે છે કે પડે નહીં.
Egg (એગ) ઈંડુ.
Look (લુક) જોવું.
Look for (લુક ફૉર્) શોધવું.
Shame (શેઇમ્) શરમ.
Pass(પાસ ઓન્) ચાલ્યા જવું.

Page 26 (પેઇજ ટ્વેન્ટી સીકસ્થ) પાનું છવીસમું.

Old (ઑાલ્ડ) ઘરડું.
Bold (બૉાલ્ડ) બહાદુર.
Cold (કૉલ્ડ) ઠંડું.
Told (ટૉાલ્ડ) કહ્યું.
Ow (ઓ) નો મીનીંગ થતો નથી.
Glow (ગ્લો) પ્રકાશ.
Grow (ગ્રો) ઉગવું, થવું.
Crow (ક્રો) કાગડો.
Ay (એ)નો મીનીંગ થતો નથી.
Say (સે) કહેવું.
Way (વે) રસ્તો.
Gay (ગે) આનંદી.
Caw (કૉ) કા. કા. કરવું.
Saw (સૉ) જોવું, કરવત.

Lesson 10 (લેશન ધી ટેન્થ) પાઠ દશમો.

Had Set અસ્ત પામ્યો હતો.
Coat (કોટ) ઢાંકણુ, (ચામડી.)
As that of the craw(એઝ ધેટ ઓફ ધ ક્રૉ) કાગડાના માળાના જેટલો.

We had અમારે સખળાને હતો.
Play (પ્લે) રમતં.
At last (એટ લાસ)આખરે.
It got cold too ટાઢ પડી.

Page 32 (પેઇજ થર્ટી ટુ) પાનું બત્રીસમું.

શબ્દના પાઠો.

Ife (આઇફ) નો અર્થ થતો નથી.
Fife (ફાઇફ) પાંચમી.
Life (લાઇફ) જીંદગી.
Rife (રાઇફ) ચંચળ.
Wife (ઉવાઇફ) વહુ.
Strife (સ્ટ્રાઇફ) કજીઓ.
Ike (આઇક) નો અર્થ થતો નથી.
Dike (ડાઇક) ખાઇ.
Like (લાઇક) ને ગમવું, ચાહવું.
Strike (સ્ટ્રાઇક) હડતાળ.
Ile (આઇલ) નો અર્થ થતો નથી.
Bile (બાઇલ) ગુંમડું.
File (ફાઇલ) કાનસ.
Mile (માઇલ) મૈલ.
Pile (પાઇલ) ઢગલો કરવો.
Tile (ટાઇલ) નળીઉં.
Wile (ઉવાઇલ) છળભેદ.
While (ઉવ્હાઇલ) જ્યારે.
Smile (સ્માઇલ) હસવું.
Ime (આઇમ)નોઅર્થ થતો નથી.
Lime (લાઇમ) ચૂનો.
Time (ટાઇમ) વખત.
Chime (કાઇમ) તાળ.
Crime (ક્રાઇમ) ગુન્હો.
Grime (ગ્રાઇમ) મેલ, મેંશ.
Slime (સ્લાઇમ) કાંપ (ચીકણો કાદવ).
Ipe (આઇપ) નો અર્થ થતો નથી.
Pipe (પાઇપ) નળી.
Wipe (ઉવાઇપ) લુછવું.
Ripe (રાઇપ) પાકું.
Stripe (સ્ટ્રાઇપ) પટો.
Ive (આઇવ) નો અર્થ થતો નથી.
Dive (ડાઇવ) ડુબકી મારવી.
Five (ફાઇવ) પાંચ.

Hive (હાઇવ) મધપૂડો.
Drive (ડ્રાઇવ) હાંકવું.
Strive (સ્ટ્રાઇવ) યત્ન કરવો.
Thrive (થ્રાઇવ) પડતી થવી.
Igh (આઇ) નો અર્થ થતો નથી.
Nigh (નાઇ) પાસે.
Sigh (સાઇ) નિશાસો.
Ight (આઇટ)નો અર્થ થતો નથી.
Fight (ફાઇટ) લડવું.
Light (લાઇટ) રોશની.
Might (માઇટ) જોર.
Night (નાઇટ) રાત.
Right (રાઇટ) જગણો.
Sight (સાઇટ) નજર.
Tight (ટાઇટ) મજબુત.
Wight (ઉવાઇટ) ભાર.
Bright (બ્રાઇટ) પ્રકાશીત.
Fright (ફ્રાઇટ) ધાસ્તી.
Blight (બ્લાઇટ) ઝાડને થતો રોગ.
Plight (પ્લાઇટ) સ્થિતિ.
Flight (ફ્લાઇટ) નાસભાગ.
Slight (સ્લાઇટ) જરા.
Ize (આઇઝ)નો અર્થ થતો નથી.
Size (સાઇઝ) કદ.
Ise (આઇઝ) નો અર્થ થતો નથી.
Rise (રાઇઝ) ઉગવું, (સૂર્યનું)
Wise (ઉવાઇઝ) ડાહ્યો.
Ild (આઇલ્ડ)નો અર્થ થતો નથી.
Mild (માઇલ્ડ) શીળો.
Wild (ઉવાઇલ્ડ) જંગલી.
Child (ચાઇલ્ડ) છોકરૂં.
Ind (આઇન્ડ) નો અર્થ થતો ન થી
Bind (બાઇન્ડ) બાંધવું.
Find (ફાઇન્ડ) જમવું.
Hind (હાઇન્ડ) પાછલા, હરણી.
Kind (કાઇન્ડ) માયાળુ, જાત.
Mind (માઇન્ડ) મગજ મન.
Rind (રાઇન્ડ) છાલ.
Wind (ઉવાઇન્ડ) લપેટવું.
Blind (બ્લાઇન્ડ) આંધળું.
Ui (આઇ) નો અર્થ થતો નથી.
Guide (ગાઇડ) ભોમીઓ, દોરવવું.
Guile (ગાઇલ) કપટ.
Guise (ગાઇઝ) પોષાક.
Oe (ઓ) નો અર્થ થતો નથી.
Doe (ડો) હરણી.
Foe (ફો) દુશ્મન.

Hoe (હો) પાવડો.
Roe (રો) માછલીનાં ઈંડાં.
Toe (ટો) અંગૂઠો (પગનો).
Woe (વો) દુ:ખ.
Floe (ફ્લો) તરતા બરફનો ઢગલો.
Obe (ઓબ)નો અર્થ થતો નથી.
Lobe (લોબ) લાલી (કાનની).
Robe (રોબ) ઝભ્ભો.
Globe (ગ્લોબ) ગોળો (પૃથ્વીનો)
Probe (પ્રોબ) પ્રેષણી, ઘા જોવાની સળી.
Ode (ઓડ) નો અર્થ થતો નથી.
Bode (બોડ) અગાઉથી ચેતવવું
Code (કોડ) કાયદા સંગ્રહ.
Mode (મોડ) રીત.
Node (નોડ) ગાંઠ.
Rode (રોડ) સ્વારી કરી.
Oke (ઓક)નો અર્થ થતો થથી.
Coke (કોક) કોલસા બાળીને કરેલો કોયલો.
Poke (પોક) ભોંકવું, ગજવું.
Woke (વોક) જાગ્યો.
Yoke (યોક) જોડવું.
Broke (બ્રોક) ભાંગ્યો.
Choke (ચોક) શ્વાસ રૂંધવો.
Stroke (સ્ટ્રોક) ઝપાટો.
Ole (ઓલ) --
Dole (ડોલ) હિસ્સો.
Hole (હોલ) બાકું.
Mole (મોલ) તાલ, છછુંદર.
Pole (પોલ) વાંસ, લાકડી.
Sole (સોલ) તળીઉ.
Stole (સ્ટોલ) ચોર્યું.
Ome (ઓમ) નો અર્થ થતો નથી
Dome (ડોમ) ઘુમટ.
Home (હોમ) ઘર.
One (ઓન) અર્થ થતો નથી.
Bone (બોન) હાડકું.
Cone (કોન) શંકુ.
Hone (હોન) પથરી (ચપ્પુ ઘસવાની.)
Lone (લોન) એકલું. છડો.
Tone (ટોન) અવાજ.
Drone (ડ્રોન) સુસ્ત માણસ.
Prone (પ્રોન) નીચી ડોકવાળું.
Stone (સ્ટોન) પથ્થર.
Throne (થ્રોન) ગાદી.

Ose (ઓઝ) નો અર્થ થતો નથી.
Dose (ડોઝ) ઝોકા ખાવા.
Hose (હોઝ) પગનાં મોજાં.
Nose (નોઝ) નાક.
Pose (પોઝ) શરદી.
Rose (રોઝ) ગુલાબનું ફુલ.
Chose (ચોઝ) પસંદ કર્યું.
Close (ક્લોઝ) પાસે.
Prose (પ્રોઝ) ગદ્ય,
Those (ધોઝ) પેલા, તે.
Ote (ઓટ) નો અર્થ થતો નથી.
Dote (ડોટ) પહેરામણી.
Mote (મોટ) રજ.
Note (નોટ) અવાજ.
Vote (વોટ) મત.
Rote (રોટ) ગોખણપટ્ટી.
Wrote (રોટ) લખ્યું.
Ove (ઓવ) --
Cove (કોવ) ખાડી, સેવવું.
Hove (હોવ) સોજો આવવો.
Rove (રોવ) ભટકવું.
Wove (ઉવોવ) વણ્યું.
Drove (ડ્રોવ) હાંક્યું,
Grove (ગ્રોવ) ઘટા.
Trove (ટ્રોવ) જડે તે.
Strove (સ્ટ્રોવ) યત્ન કર્યો.
Oor (ઓર) --
Door(ડોર) બારણું.
Floor (ફ્લોર) જમીન પાટીયાની

Page, 34

Ea (ઇ) નો મીનીંગ થતો નથી.
Sea (સી) દરીયો.
Tea (ટી) ચાહ.
Pea (પી) વટાણો.
Eek (ઇક)નો મીનીંગ થતો નથી.
Seek (સીક) શોધવું.
Week (વીક) અઠવાડીઉ.
Greek (ક્રીક) ખાડી.
Ere (એર) અગાઉ.
Were (વેર) હતાં.
Where (વ્હેર) ક્યાં,
There (ધેર્) ત્યાં,
Tell (ટેલ) કહેવું
Shell (શેલ)બદીશ્યકાળની વીછાની
Sea-shore (શી શોર્) દરીયા
Fine (ફાઇન) સુંદર. [કીનારે,
Last (લાસ્ટ) છેલ્લાં, ગયા.

Bay (બે) અખાત. [કીટલું.
Egg-shell (એગ શેલ) ઈંડાનું
Shell-fish (શેલ ફીશ) માછ-
લાની શીપ. [જેટલી મોટી.
As big as a pea વટાણા
To wade (ટુ વેઈડ) પાણી-
માં ચલાવવાને [કીનારો.
Sea-side (સી-સાઈડ) દરીયા
we-ball દડાની રમત રમવા ગયા.

Page. 36

Ace (એઈસ)મીનીંગ થતો નથી.
Face (ફેઈસ) ચહેરો.
Race (રેઈસ) જાત.
Place (પ્લેઈસ) જગ્યા.
Eel (ઈલ) બામ માછલી.
Feel (ફીલ) લાગતું.
Keel (કીલ) વહાણનો પઠાણ.
Reel (રીલ) દોરીનું પતું.
Each (ઈચ) દરેક.
Teach (ટીચ) શીખવતું.
Beach (બીચ) કીનારો.
Reach (રીચ) પહોંચતું.
Dick (ડિક) છોકરાનું નામ છે.
Mast (માસ્ટ) ડોળ.

Sail (સેઈલ) સઢ.
How to fish=માછલી કેવી
રીતે પકડવી.
Ran a race=શરત રમ્યા.
Ned fell-face+નેડ ઉંધે મા-
થે પડયો.
He set-sail=તેણે સઢ ચઢાવ્યો.

Page 38.

Oon (ઊન)નો મીનીંગ થતો નથી.
Moon (મૂન) ચંદ્ર.
Noon (નુન) બપોર.
Soon (સુન) જલદીથી.
Ew (યુ) નો મીનીંગ થતો નથી.
New (ન્યુ) નવું.
Dew (ડયુ) ઝાકળ-દવ.
Blew (બ્લ્યુ) વાયો.
Flew (ફ્લ્યુ) ઉડયું.
Grew (ગ્રયુ) ઉગ્યું. થયું.
Crew (ક્રયુ) ખલાસી.
Drew (ડ્રયુ) ખેંચ્યું.
Gust (ગસ્ટ) વાવાઝોડું.
Got off(ગૉટ ઑફ)બહાર કાઢી.

Page 40

Ave (એવ) મીનીંગ થતો નથી.

Cave (કેવ) ગુફા.
Gave (ગેવ) આપ્યું.
Save (સેવ) બચાવવું.
Wave (વેવ) મોજુ ઉછાળવું.
Brave (બ્રેવ) બહાદુર.
Are (એર)નો મીનીંગ થતો નથી.
Bare (બેર) ખુલ્લું.
Care (કેર) કાળજી.
Dare (ડેર) હિંમત ધરવી.
Hare (હેર) સસલું.
Share (શેર) ભાગ-વહેંચવું.
Got up (ગૉટઅપ) ઉઠયો.
As fast-hare=સસલા જેટ-
લી ઝડપથી.
At the end=છેડે. બપોર થયા
When a noon came જ્યારે

Page 42.

Im (ઇમ) નો મીનીંગ થતો નથી.
Trim (ટ્રિમ) ઠીક કરવું.
Swim (સ્વિમ) તરવું.
Eep (ઇપ) —
Deep (ડીપ) ઊંડું.
Steep (સ્ટીપ) સીધું.
Ear (ઇઅર) કાન.

Fear (ફીઅર) ધાસ્તી.
Clear (કલીઅર) સ્વચ્છ.
Ess (એસ) —
Less (લેસ) વધારે નાનું.
Dress (ડ્રેસ) કપડાં પહેરવાં.
Teach (ટીચ) શીખવવું.
Deep (ડીપ) ઉંડુ.
Feel (ફીલ) લાગવું.
So high-is=તેના જેટલો મોટો.
Blame (બ્લેઇમ)ઠપકો આપવો.
The more-fear=જેમ જેમ
હું વધારે કોશિષ કરીશ તેમ તેમ
મને વધારે ઓછી ધાસ્તી લાગશે.

Page. 44

Oll (ઓલ) નો મીનીંગ થતો નથી.
Boll (બોલ) શીંગ, ફળી.
Poll (પોલ) આપેલા મત, માથું.
Roll (રોલ) ગબડાવવું.
Toll (ટોલ) ઘંટ વગાડવો,
Droll (ડ્રોલ) ગમતી, ટીખળી.
Stroll (સ્ટ્રોલ) લટારકરવું.
Ost (ઓસ્ટ) ∠
Most (મોસ્ટ) ઘણું.
Post (પોસ્ટ) થાંભલો.

Ghost (ઘોસ્ટ) ભૂત.
Olk (ઓક)—
Folk (ફોક) માણસ.
Yolk (યોક) જરદી.
Oal (ઓલ) —
Coal (કોલ) કોયલો.
Foal (ફોલ) વછેરો.
Goal (ગોલ) મુકામ.
Shoal (શોલ) ટોળું.
Oam (ઓમ) —
Foam (ફોમ) ફીણ.
Loam (લોમ) ભમરીની મટોડી.
Roam(રોમ) ભટકવું.
Oan (ઓન) —
Loan (લોન) દેવું. ધીરવું.
Moan (મોન) વિલાપ કરવો.
Roan (રોન) કાબરચીતરૂં.
Groan (ગ્રોન) દુઃખથી બુમ [પાડવી.
Oap (ઓપ)—
Soap (સોપ) સાબુ
Oar (ઓર) હલેસવું.
Boar (બોર) ડુક્કર.
Roar (રોર) ગર્જના.
Soar (સોર) ઉંચે ઉડવું.
Oast (ઓસ્ટ) —
Boast (બોસ્ટ) બગફરી કરવી.
Coast (કોસ્ટ) કિનારો.
Roast (રોસ્ટ) શેકવું.
Toast (ટોસ્ટ) સેકવું.
Ull (ઉલ) —
Bull (બુલ) ગોધો.
Full (ફુલ) ભરેલું.
Pull (પુલ) ખેંચવું.
Ush (ઉશ) —
Bush (બુશ) ઝાડી.
Push (પુશ) ધક્કો મારવો.
Ue (યુ) —
Cue (ક્યુ) અંબોડો, સૂચના.
Due (ડ્યુ) લહેણું, વ્યાજબી.
Hue (હ્યુ) રંગ.
Rue (ર્યુ) સીતાબ, બ્રહ્મી.
Sue (સ્યુ) દાવો કરવો.
Blue (બ્લ્યુ) આસમાની.
Flue (ફ્લ્યુ) હવાટો.
Glue (ગ્લ્યુ) સરેશ.
True (ટ્રુ) સાચું.
Ube (યુબ) —

Cube (ક્યુબ) ઘન.
Tube (ટ્યુબ) નળી.
Ude (ઉડ)—
Rude (રૂડ) જંગલી.
Crude (ક્રૂડ) કાચુ.
Ule (ઉલ) —
Rule (રૂલ) કાયદો.
Mule (મ્યુલ) ખચર.
Une (ઉન) —
Rune(રૂન)રૂનિક ભાષાના અક્ષર.
Tune (ટ્યુન) અવાજ, રાગ.
Ure (યુર) —
Cure (ક્યુરે) મટાડવું.
Lure (લ્યુર) લાલચ.
Pure (પ્યુર) ચોખ્ખું.
Use (યુઝ) વાપરવું.
Fuse (ફ્યુઝ) ગાળવું.
Ute (યુટ) —
Mute (મ્યુટ) મૂગું.
Lute (લ્યુટ) સારંગી, સરેશ.
Flute (ફ્લ્યુટ) વાંસળી.
Brute (બ્રુટ) જડ, ભાન વિનાનું

Page 45.

Oo (ઊ) નો મીનીંગ થતો નથી
Too (ટૂ) પણ, વળી.
Woo (વુ) પ્યાર કરવો.
Oof (ઊફ) —
Roof (રૂફ) છાપરૂં.
Woof (વુફ) વાણો.
Proof (પ્રૂફ) સાબેતી.
Oom (ઊમ) —
Boom (બુમ) ધાંટો પાડવો, સઢ નીચેની કાથી.
Doom (ડુમ)ભાવી,ચૂકાદો કરવો
Loom (લુમ) શાળ.
Room (રૂમ) ઓરડી.
Broom (બ્રૂમ) સાવરણી.
Bloom (બ્લૂમ) મોર, જોબન.
Gloom (ગ્લૂમ) અંધકાર, ઉદાસી
Groom (ગ્રૂમ) ઘોડાવાળો.
Oor (ઊર) —
Boor (બુર) ગામડીઓ.
Poor (પૂઅર) ગરીબ.
Moor (મૂર)હબસી,ભીની જગ્યા.
Oop (ઊપ) —
Hoop (હુપ) પટો.
Loop (લૂપ) ફાંસો.

Droop (ડ્રુપ) નમી જવું.
Sloop (સ્લૂપ) એક સઢનું વહાણ
Stoop (સ્ટૂપ) નીચું વળવું.
Swoop (સ્વુપ) ઝાપટ મારવી.
Whoop (હુપ) બુમ પાડવી.
Ooth (ઊથ) —
Booth (બુથ) માંડવો.
Sooth (સૂથ) ખરૂં,ભવિષ્ય કથન.
Tooth (ટૂથ) દાંત.
Smooth (સ્મૂથ) લીસું.
Oo-e (ઊ) —
Soothe (સૂધ) સાચું હોવાથી
કબુલ કરવું.
Groove (ગ્રુવ) ખોભણ.
Ove (ઊવ)—
Move (મૂવ) ખસેડવું.
Prove (પ્રૂવ) સાબેત કરવું.
Ou (યુ)-
You (યુ) તમે
Your (યૉર) તમારૂં.
Could (કુડ) Can નો ભૂતકાળ
Would (ઉડ) Willનો ભૂતકાળ
Should (શુડ) Shall નો ભૂ-
તકાળ.
Ar (ઑર)—
War (ઉવૉર) લઢાઈ.
Ward (ઉવૉર્ડ) ચોકી.
Warm (ઉવૉર્મ) ગરમ.
Swarm (સ્વૉર્મ) ટોળું,
Alt (ઑલ્ટ)—
Halt (હૉલ્ટ) મુકામ કરવો.
Malt(મૉલ્ટ)જવનું ખીર બનાવવું.
Salt (સૉલ્ટ) મીઠું.
Aul (ઑલ) —
Hall (હૉલ) ઘસડવું.
Fault (ફૉલ્ટ) ગુન્હો–ભુલ.
Vault (ઉવૉલ્ટ) ઘુમટ.
Aw (ઑ) —
Daw (ડૉ) એક જાતનું પક્ષી.
Jaw (જૉ) જડબું
Law (લૉ) કાયદો.
Raw (રૉ) કાચું.
Claw (ક્લૉ) પંજો.
Flaw (ફ્લૉ) ફાટ.
Draw (ડ્રૉ) ખેંચવું.
Straw (સ્ટ્રૉ) ઘાસ.

Awl (ઑાલ) —
Bawl (બૅાલ) ધાટા પાડવા.
Brawl (બ્રૅાલ) કજીઓ.
Crawl (ક્રૅાલ) પેટ ચાલવું.
Drawl (ડ્રૅાલ) ઉંઘણુસીની પેઠે બોલવું.
Shawl (શૅાલ) શાલ.
Sprawl (સ્પ્રૅાલ)લાંબા થઇનેસૂવું.
At (ઍાટ) —
What (હ્વૅાટ) શું, જે,તે.
Watch (હ્વૅાચ) તપાસવું, નાનું ઘડીઆળ.

Page. 46

Arm (આર્મ) હાથ.
Farm (ફાર્મ) ખેતર.
Harm (હાર્મ) ઇજા.
Ard (આર્ડ) —
Hard (હાર્ડ) સખત.
Yard (યાર્ડ) વાડો, વાર.
Ain (એઇન) —
Rain (રેઇન) વરસાદ.
Train (ટ્રેઇન) હાર, કેળવવું, આગગાડી.

Een (ઇન)
Been (બીન) થયલું.
Seen (સીન) જોયલું.
I have–farm=હું ખેતરમાં રહેવા આવ્યો છું.
Had seen(હૅડસીન) જોયું હતું
Till–week=ગયા અઠવાડીઆ સુધી.
Bill (બીલ) છોકરાનું નામ છે.
Show (શો) બતાવવું.
All that=જે સઘળું.
Rain came on=વરસાદ આવ્યો–પડયો.
I had on=મેં પહેર્યો હતો.
At all (ઍટઑાલ) બીલકુલ.
It–yard=વાડામાં એટલો ભેજ અને ઠંડક હતી કે મારાથી તેમાં રહેવાય નહીં.
To take off=કાઢી નાંખવું.
We had–in=અમારે અંદર થોભવું પડયું.
To get wet=ભીનું થવું.
We–bed સુવાને ગયા.

For the rain-cold=વરસાદ અને ટાઢને લીધે.

Page 48.

Ow (આઉ) નો થતો નથી.
Now (નાઉ) હમણાં.
How (હાઉ) કેવી રીતે.
Cow (કાઉ) ગાય.
Ate (એઇટ) ખાધું.
Late (લેઇટ) મોડું.
Gate (ગેઇટ) દરવાજો.
Slate (સ્લેઇટ) પથ્થરપાટી.
Ire (આયર) ગુસ્સો.
Fire (ફાયર) આગ. [ની વાટ.
Tire (ટાયર) થાકી જવું, પૈડાં-
Mire (માયર) કાદવ
The day that (ધ ડે ધૅટ) જે દીવસે.
There is (ધેરઇઝ) છે. There નો અર્થ ન કરવો.
Al that (ઑલધૅટ) જે સઘળુ
It would-me=તે મને કંટાળો આપશે.
I saw go out=મેં બહાર જતી જોઇ.

I must-Slate=મારી પથ્થરપાટીપર ગાય દોરવાને મારે કોશીષ કરવી જોઇએ.
Made for the gate દરવાજા તરફ નાઠું.
To make him run=તેને દોડાવવાને.
Dish (ડિશ) રકાબી. થાળી.
As the pig did-As the pig ran=જેમ ડુક્કર દોડી જતું.

Page. 50.

Ool (ઊલ) નો મીનીગ થતોનથી
Pool (પૂલ) ખાબોચીઉં.
School (સ્કુલ) નીશાળ.
Oose (ઊઝ.) —
Goose (ગૂઝ) હંસ
Noose (નૂઝ) ફાંસો. ગાળો.
Ope (ઓપ) —
Rope (રોપ) દોરડું.
Slope (સ્લોપ) હાર. ઢોળાવ.
Ow (આઉ) —
Down (ડાઉન) નીચે.
Town (ટાઉન) શહેર.
Neck (નેક) ગરદન.

She saw-run=તેણે દોડતો જોયો.
Flew (ફ્લ્યુ) ઊડયું.
This made-back=એથી ગ-
ધેડાને પાછું ફરવું પડયું.
End (એન્ડ) છેડો.

Page 52

Qund (ઉન્ડ)મીનીંગ થતો નથી.
Round(રાઉન્ડ)ગોળ, આસપાસ.
Found (ફાઉન્ડ) જડયું.
Hound (હાઉન્ડ) શિકારી કુતરો
Oad (ઓડ) —
Road (રોડ) રસ્તો.
Toad (ટોડ) દેડકો.
Load (લોડ) ભાર, ભાર ભરવો.
Ey (એ) —
Grey (ગ્રે) કાબરચિત્રું
Prey (પ્રે) શિકાર.
They (ધે) તેઓ.
At the-it=તેની બાજુએ.
Grey-hound=શિકારી કુતરો.
Hare (હેર) સસલું.
Just as (જસ્ટ ઍઝ) જેમ.
As well as=તેમજ.
Grass (ગ્રાસ) ઘાસ

Page. 54.

Oot (ઊટ) નો મીનીગ થતોનથી
Boot (બુટ) જોડો, નફો થવો.
Foot (ફૂટ) પગ.
Root (રૂડ) મૂળ.
Orn (ઑાર્ન) —
Corn (કૉર્ન) અનાજ.
Torn (ટૉર્ન) ફાટેલું, ફાડયું.
Thorn (થૉર્ન) કાંટો.
Edge (એજ) કોર.
Sedge (સેજ) ડાભ.
Hedge (હેજ) વાડ.
I did-down=મેં અનાજ
કાપેલું જોયું નહીં.
It was-then=ત્યારે તે કાપવા
જેટલું મોટું થયું નહતું.
Tore (ટોર) ફાડયો.
Was torn (ઉવૉઝ ટૉર્ન) ફાટ
યો હતો. [સારું.
I-had=મારી પાસે હોતતો કેવું
Cut doun(કટ ડાઉન) કાપેલું.

Words exercises (વર્ડ્ઝ એક્સરસાઇઝીઝ) શબ્દોના પાઠ.

Long and short vowel sounds (લૉન્ગ એન્ડ સોર્ટ વોવેલ સાઉન્ડઝ)

સ્વરના ટુંકા તથા લાંબા ઉચ્ચાર તથા તેનો અર્થ.

A ટુંકો.	A લાંબો.
Bat (બૅટ) ચામાચેણુ.	Bait (બેઇટ) લાલચ.
Fat (ફૅટ) જાડો.	Fate (ફેઇટ) નસીબ.
Hat (હૅટ) ઉભી ટોપી.	Hate (હેઇટ) ધિક્કારવું.
Mat (મૅટ) સાદડી.	Mate (મેઇટ) નર.
Rat (રૅટ) ઉંદર.	Rate (રેઇટ) દર.
Ban (બૅન) ઢંઢેરો.	Bane (બેઇન) વીખ.
Can (કૅન) શકવું, તામડી.	Cane (કેઇન) નેતર.
Fan (ફૅન) પંખો	Fane (ફેઇન) મંદિર. Fain (ફેઇન) ખુશી.
Man (મૅન) માણસ.	Mane (મેઇન) યાળ. Main (મેઇન) મુખ્ય.
Pan (પૅન) કઢાઇ.	Pane (પેઇન) કાચનો તકતો. Pain (પેઇન) દરદ.
Van (વૅન) ગાડી	Vane (વેઇન) વાયુગતી દર્શક યંત્ર. Vain (વેઇન) ફોગટ.
Sham (શૅમ) ઠગાઇ	Shame (શેઇમ) શરમ

Long (લોંગ) લાંબા.	Vowels (વૉવેલ્સ) સ્વરો.
Short (સોર્ટ) ટુંકા.	Sounds (સાઉન્ડઝ) અવાજો ઉચ્ચાર

Lad (લૅડ) છોકરો.

Mad (મૅડ) ગાંડો.

Pad (પૅડ) નરમ ચાલનારો ઘોડો.

A ટુંકો.

Cap (કૅપ) ટોપી.

Gap (ગૅપ) બાકું.

Tap (ટૅપ) ટચકો.

Bar (બાર) સળીઓ.

Car (કોર) ગાડી.

Far (ફાર) દૂર.

Mar (માર) બગાડવું.

Bath (બાથ) હમામખાનું.

Lath (લાથ) પકવાસો.

e ટુંકો ઉચ્ચાર.

Bed (બેડ) બિછાનું.

Fed (ફેડ) ખવાડયું.

Led (લેડ) દોર્યો.

Red (રેડ) રાતું.

Read (રેડ) વાંચ્યું.

Man (મૅન) માણસો.

Bet (બેટ) સરત.

Met (મેટ) મલ્યો.

Net (નેટ) જાળ.

ટુંકો.

Pet (પેટ) વહાલું.

Laid (લેઈડ) મૂકયું.

Made (મેઇડ) બનાવ્યું.

Maid (મેઇડ) કન્યા

Paid (પેઇડ) પૈસા આપ્યા.

A લાંબો.

Cape (કેઇપ) ભુશીર.

Gape (ગેઇપ) ખાવું.

Tape (ટેઇપ) ફીત.

Bare (બેર) ખુલ્લું.

Bear (બેર) રીંછ.

Care (કેર) સંભાળ.

Fare (ફેર) ભાડું.

Fair (ફેર) સુંદર.

Mare (મેર) ઘોડી.

Bathe (બેઇથ) નાહાવું.

Lathe (લેઇધ) સંઘાડો.

e લાંબો ઉચ્ચાર.

Bead (બીડ) કાડીઉં.

Feed (ફીડ) ખવડાવવું.

Lead (લીડ) દોરવું.

Reed (રીડ" બરૂ.

Read (રીડ) વાંચવું.

Mean (મીન) નીચ.

Beat (બીટ) મારવું.

Meet (મીટ) મળવું.

Meat (મીટ) માંસ.

Neat (ની [illegible]ટ) સ્વચ્છ.

લાંબો.

Peat (પીટ) કોહેલો સૂકાયલો.

Set (સેટ) મૂકવું.
Best (બેસ્ટ) સૌથી સારૂં
I ટુંકો ઉચ્ચાર.
Bid (બીડ) ફરમાવવું.
Hid (હિડ) સંતાડયું.
Rid (રિડ) દૂર કાઢવું.
Bill (બિલ) ચાંચ.
Fill (ફીલ) ભરવું.
Mill (મીલ) ઘંટી
Till (ટીલ) ખેડવું.
Will (ઉવીલ) મરજી.
Din (ડીન) ઘોંઘાટ.
Fin (ફિન) પાંખ (માછલીની)
Pin (પિન) ટાંકણી.
Win (ઉવિન) જીતવું.
Pip (પિપ) ચીંચીં કરવું.
Rip (રિપ) ચીરવું.
Fir (ફર) દેવદાર.
Sir (સર) સાહેબ.
Bit (બીટ) કરડયો.
Sit (સિટ) બેસવું.
ટુંકો.
Wind (ઉવિન્ડ) પવન.
Rem (રિમ) ઝાંખું.
O ટુંકો ઉચ્ચાર.
Rob (રૉબ) લૂટવું.
Cod (કૉડ) માછલી.
Rod (રૉડ) સોટી.

Seat (સીટ) બેઠક.
Beast (બીસ્ટ) પશુ.
I લાંબો ઉચ્ચાર.
Bide (બાઇડ) રહેવું.
Hide (હાઇડ) છુપાવવું.
Ride (રાઇડ) સ્વાર થવું.
Bile (બાઇલ) પિત્ત.
File (ફાઇલ) કાનસ.
Mile (માઇલ) મૈલ.
Tile (ટાઇલ) નળીઉં.
Wile (ઉવાઇલ) કાવેદાવો.
Dine (ડાઇન) જમવું.
Fine (ફાઇન) દંડ.
Pine (પાઇન) દુઃખ પામવું.
Wine (ઉવાઇન) દારૂ.
Pipe (પાઇપ) વાંસળી.
Ripe (રાઇપ) પાકું.
Fire (ફાયર) દેવતા.
Sire (સાયર) સાહેબ.
Bite (બાઇટ) કરડવું.
Site (સાઇટ) જગ્યા.
લાંબો.
Wind (ઉવાઇન્ડ) લપેટવું.
Rime (રાઇમ) ઠરેલી ઝાકળ.
O લાંબો ઉચ્ચાર.
Robe (રોબ) ઝભ્ભો.
Code (કોડ) કાયદા સંગ્રહ.
Rode (રોડ) સ્વારી કરી.

	Road (રોડ) રસ્તો.
Hop (હૉપ) કુદવું.	Hope (હોપ) આશા રાખવી.
Mop (મૉપ) કુચો.	Mope (મોપ) --
For (ફૉર) માટે.	Four (ફોર) ચાર.
	Fore (ફોર) આગલો.
Cot (કૉટ) પલંગ.	Coat (કોટ) ડગલો. [ખવું.
Dot (ડૉટ) મીંડું.	Dote (ડોટ) અતીશય હેત રા-
Got (ગૉટ) મેળવ્યું.	Goat (ગોટ) બકરો.
Not (નૉટ) નહીં.	Note (નોટ) અવાજ.
Rot (રૉટ) ચળો.	Rote (રોટ) મ્હોંઢે.
U ટુંકો ઉચ્ચાર.	U લાંબો ઉચ્ચાર.
Cub (કબ) વાઘનું બચ્ચું.	Cube (કયુબ) ઘન.
Tub (ટબ) પીપ.	Tube (ટયુબ) નળી.
Cud (કડ) વાગોળ.	Could (કુડ) શકયું.
Cull (કલ) ચુંટી કાઢવું.	Cool (કુલ) ઠંડું.
Rum (રમ) એક જાતનો દારૂ.	Room (રૂમ) ઓરડી.
Bun (બન) પૂરી.	Boon (બુન) બક્ષીસ.
Sun (સન) સૂરજ.	Soon (સૂન) તરતજ.
Son (સન) છોકરો.	[જરૂં, (મરઘા, વિગેરે માટે)
Cup (કપ) પ્યાલુ.	Coop (કુપ) સળીઆવાળું પાં-
Sup (સપ) વાળુ કરવું.	Soup (સૂપ) સેરવો, સૂર.
Cur (કર) હલકી જાતનો કૂતરો.	Cure (કયુર) મટાડવું.
Purr (પર) મીઆંઉ મીઆંઉ કરવું.	Pure (પ્યુર) સ્વચ્છ.
But (બટ) પણ,	Boot (બુટ) જોડા.
Hut ઝૂંપડું.	Hoot (હુટ) ઘુંઅડની પેઠે બોલવું,
Rut (રટ) ચીલો,	Root (રૂટ) મૂળીઉં,

Shut (શટ) બંધ કરવું.

Shoot (શૂટ) ગોળી મારવી.

A ટુંકો ઉચ્ચાર.

Harp (હાર્પ) સારંગી.
Rasp (રાસ્પ) કાનસ
Barn (બાર્ન) કોઠાર.
Bard (બાર્ડ) ભાટ.
That (ધૅટ) કે-જે-તે-પેલું,
Farm (ફાર્મ) ખેતર.
Dash (ડૅશ) ધસવું.
Man (મૅન) માણસ.
Ant (ઍન્ટ) કીડી.
Car (કાર) ગાડી.
Has (હૅઝ) પાસે છે.
Shall (શૅલ) ભવિષ્ય કાળની નિશાની.

A દીર્ઘ ઉચ્ચાર.

Warp(ઉવૉર્પ)તાણો(ઉભોદોરો.)
Wasp (ઉવૉસ્પ) ભમરો.
Warn (ઉવૉર્ન) ચેતવણી આપવી.
Ward(ઉવૉર્ડ) ચોકી કરવી તે.
What (ઉવૉર્ટ) શું જે તે.
Warm (ઉવૉર્મ) ગરમ.
Wash (ઉવૉશ) ધોવું.
Wan (ઉવૉન) ફિક્કું.
Want (ઉવૉન્ટ) માંગવું.
War (ઉવૉર) લડાઇ.
Was (ઉવૉઝ) હતો.
Call (કૅાલ) બોલાવવું.

A ટુંકો ઉચ્ચાર.

Have (હૅવ) પાસે છે.
Are (આર) છે.
Bade (બાડ) ફરમાવ્યું.

A દીર્ઘ ઉચ્ચાર.

Gave (ગેવ) આપ્યું.
Bare (બેર) ખુલ્લું.
Made (મેઇડ)

E હ્રસ્વ ઉચ્ચાર.

There (ધેર) ત્યાં.
Were (ઉવેર) હતા.
Where (ઉહ્વેર) ક્યાં જ્યાં.

E દીર્ઘ ઉચ્ચાર.

Here (હીઅર) અહીંઆં.
Mere (મીઅર) માત્ર.

Ea હ્રસ્વ.

Head (હેડ) માથું.
Lead (લેડ) સીસું.

Ea દીર્ઘ.

Read (રીડ) ભણ્યો.
Lead (લીડ) દોરવું.

Read (રેડ) વાંચ્યું.	Read (રીડ) વાંચવું.
Dead (ડેડ) મૂએલું.	Mead (મીડ) બીડ.
Bread (બ્રેડ) રોટલી.	Plead (પ્લીડ) કાલાવાલા કરવા.
Tread (ટ્રેડ) પગ મૂકવો.	Sea (સી) દરીઓ.
Dread (ડ્રેડ) ભય.	Plea (પ્લી) બાહાનું.
Deaf (ડેફ) બેહેરૂં.	Leaf (લીફ) પાંદડું.
Breath (બ્રેથ) શ્વાસ.	Breathe (બ્રીથ) શ્વાસ લેવો.
Death (ડેથ) મોત.	Heath(હીથ) એક જાતનો છોડ.
Stealth (સ્ટેલ્થ) ચોરી.	Steal (સ્ટીલ) ચોરી કરવી.
Health (હેલ્થ) તંદુરસ્તી.	Heal (હીલ) મટાડવું.
Wealth (ઉવેલ્થ) દોલત.	Weal (ઉવીલ) સુખ.
Meant (મેન્ટ) ઇચ્છયું.	Mean (મીન) હલકું.
Leant(લેન્ટ)અઢેલીને ઉભા રહ્યા.	Lean (લીન) પાતળું.
Bear (બેર) રીંછ	Dear (ડીઅર) વહાલું.
Wear (ઉવેર) પહેરવું	Near (નીઅર) પાસે.
Tear (ટેર) ફાડવું.	Tear (ટીઅર)
Breast (બ્રેસ્ટ) છાતી.	Beast (બીસ્ટ) પશું.
Break (બ્રેક) ભાંગવું.	Beak (બીક) ચાંચ.
Steak (સ્ટેક) માંશનો કડકો.	Weake (ઉવીક) નબળું.
Wind (ઉવિન્ડ) પવન.	Wind (ઉવાન્ડ) લપેટવું.
Live (લિવ) રહેવું.	Live (લાઇવ) જીવતું.
Give (ગિવ) આપવું.	Hive (હાઇવ) ગધપૂડો.

Doll (ડૉલ) પૂતળી	Toll (ટોલ) ઘંટ વગાડવો.
Loll (લૉલ) આળોટવું.	Roll (રોલ) ગબડાવવું.
Dost (ડૉસ્ટ) કરે છે.	Most (મોસ્ટ) ઘણુંજ.
Lost (લૉસ્ટ) ગુમાવ્યું,	Post (પોસ્ટ) થાંભલો.
Some (સમ) કેટલાંક.	Home (હોમ) મુગટ.
Come (કમ) આવવું.	Dome (ડોમ) મુગટ.
Dove (ડવ) કબુતર.	Cove (કોવ) નાની ખાડી.
Love (લવ) પ્યાર.	Wove (વોવ) વણ્યું.
U હ્રસ્વ.	U દીર્ઘ.
Dull (ડલ) સુસ્ત.	Bull (બુલ) ગોધો.
Gull (ગલ) દરીઆઇ પક્ષી.	Full (ફુલ) ભરેલું.
Hull (હલ) છોતેરાં.	Pull (પુલ) ખેંચવું.
Brush (બ્રશ) પીંછી.	Bush (બુશ) ઝાડી.
Rush (રશ) ધસવું.	Push (પુશ) હડસેલો મારવો.
But (બટ) પણ.	Rut (પુટ) મૂકવું.
O.	U.
Toe (ટો) પગનો અંગુઠો.	Shoe (શૂ) જોડો
Comb (કોમ્બ) કાંસકી.	Tomb (ટુમ્બ) કબર
Rove (રોવ) ભટકવું.	Move (મૂવ) હાલવું.
Grove (ગ્રોવ) ઝાડી,	Prove (પ્રૂવ) સાબિત કરવું.
Door (ડોર) બારણું.	Poor (પૂઅર) ગરીબ.
Floor (ફ્લોર) પાટીઆની જમીન	Moor (મૂર) ભીની જગ્યા.